

શ્રી સુધર્માસ્વામી

નિઃશ્વાસ

૨૫૦૪

અમૃત
તथा
નિઃશ્વાસ
અને
નિઃશ્વાસના એ બિન રૂપ.

અમૃત
તથા
નિઃશ્વાસ
અને
નિઃશ્વાસના એ બિન રૂપ.

અમૃત
તથા
નિઃશ્વાસ
અને
નિઃશ્વાસના એ બિન રૂપ.

: લેખક :

મૂળ રણાંશ વેદ.

॥ॐ नमो भगवते वासुदेवाय ॥

અલોકિક અમૃત

— તથા —

કર્મ - યોગ

— અને —

આર્થ સંસ્કૃતિનું

પ્રાચીન એણ્ટુ-રે-એપેરેટસ
અથવા

વિજ્ઞાનના બે લિખેં ૩૫.



: લેખક :

ક્રિ. ૦-૬-૦

મુણદ રણાધોડ વેદ

લેખક અને પ્રકાશક
મૂલળ રણુછોડ વેદ
આગાખાન બિલીંગ : દક્ષાલ સ્ટ્રીટ-મુંબઈ



આવૃત્તિ પહેલી : પ્રત ૭૫૦
૧૯૬૩ : : ૧૯૩૭



મુદ્રક :
પારી. કીખાસાઈ ગોપાળજી
શ્રીસુરસ્વતી છાપખાનું, સ્ટેશન રોડ-કાવનથર.



લેખક:
કરણ મુક્ત સુત વેદ.

॥ॐ नमो भगवते वासुदेवाय ॥

અલોકિક અમૃત



લેખક
મૂલ્ય રણુદ્ધોડ વૈદ

પ્રસ્તાવના

અમૃત, અમૃત એમ સૌ કોઈ ચોકરીને કહે છે ખરા, પરંતુ તેવી વરતુ છે કે નહિ તેનો કોઈ પણ વિચાર કરતું નથી; આ અમૃતે અનેકને ભમાય્યા છે: અનેકને તેની પ્રાસિ માટે આક્ષીં ધરસંસાર છોડાની રજગતા, રખડતા કર્યા છે. શાણુ ભાણુસો અમૃતની આવી જોહળળમાં સપડાતા નથી. વળી જાનીએ અમૃતની વાત કહેતા કે સાંલગતા નથી. અમૃતનો સાધારણ અર્થ અમરત્વ આપવાનું કે મનુષ્યને અમર કરવાનું છે.

અમરત્વ સર્વેને જોઈએ છીએ, છતાં જે ઉડો નિચાર મનુષ્ય કરશે તો મનુષ્ય માત્ર અમર છે જ. અમૃતની શાખમાં નીકળેલા પોતે જાણુતા જ નથી કે અમર કોણે કરવો છે? જે તે પોતાના દેહને અમર કરના ધૂચછતા હોય તો તે દેહ ઉત્પન્ન થયેદો હોવાથી તે કદી પણ અમર થવાનો નથી. જેની ઉત્પત્તિ તેનો નાશ એ વાત છે નિશ્ચિત. જેનો હોય જન્મ તેનું મૃત્યુ અવશ્ય છે જ. જેને હોય આદિ તેનો અંત અવશ્ય છે જ. તેથી દેહને તો તણો કહ્યા પણ અમર કરી શકવાના નથી, કે તે દેહને અમરત્વ આપવી શકવાના નથી.

હવે જે તે અમરત્વ આત્માને માટે તેઓ શોધતા હોય તો આત્મા અનાદિ હોઈ તેને તેવા અમૃતની જરૂર નથી. વળી તે આત્માને જન્મ ન હોવાથી, તેનો અંત ન હોવાથી તે બિના અમૃતપાન કરે અમર છે જ.

આ ઉપરથી સિદ્ધ થાય છે કે અમૃતની ઉપયોગીતા જે માનવામાં આવી છે તેવો લાભ અમૃતમાં નથી એ વાત સિદ્ધ થાય છે.

હવે જ્યારે અમે કહેશું કે અમૃત જેવી વસ્તુ અસ્તિમાં હતી જ નહિ, છે નહિ, અને થવાની પણ નથી, ત્યારે લોકો વિસ્તિત થશે, તેવાને આપણે વિસ્તિત થવા હેશું.

હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ અમૃતની વાત જે સાધારણું રીતે લોકામાં થાય છે; હોઠ પુરાણોમાં કે આખ્યાયિકાચોમાં અમૃતનો ઉદ્દેશ થાય છે, તે શું બોટો? અને જે બોટો હોય તો તે શા માટે કરવામાં આવે છે?

સાધુસંત, ઋષિમુનિઓ, આ જગતમાં પરોપકારાર્થે જ વિચરે છે અને અજ્ઞાની જનોને સદગુણુમાં વાળવા તથા પ્રભુમાં પ્રેરવા જે રોચક ભાષા વાપરે છે તે માંહેલી આ અમૃતની વાત સમજી લેવી.

અમૃત એ ખરી વસ્તુ નથી, પરંતુ કદ્યનાજન્ય વસ્તુ છે.

અમૃત લદે જગતમાં ન હોય, પરંતુ જે અમરત્વ આ અમૃત પ્રાપ્ત કરાવે છે, તે તો ખર્ચ છે પરંતુ તેની પ્રાપ્તિ કરવાની રહેતી નથી. દેહ કદ્દી અમર થવાનો નથી એ વાત આપણે કદ્દી જ્યા અને આત્મા અમર છે તે પણ કહ્યું, છતાં અજ્ઞાનતા એ વાત સાધારણું મનુષ્યને સ્પષ્ટ રીતે સમજવા હેતી નથી.

“ હું ” એટલે દેહનહી-પરંતુ આત્મા છું એવી વાત કળાઈ જાય એટલે અમરત્વ પ્રાપ્ત થઈ જયું એમ સમજવું. વળી પ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ સંભવતી જ નથી. આત્મા અમર છે. તેને માટે અમરત્વ પ્રાપ્ત કરવાનાર અમૃતની જરૂર ક્યાં રહી ? જ્યારે આત્માનું અસ્તિત્વ કળાઈ જાય છે અને “ હું તે આત્મા છું જ ” એનું જ્ઞાન થાય છે ત્યારે અમૃતની પાછળ મનુષ્ય ગાંડો નહીં થાય. આ વાત આ લધુ લેખ “ અલૌકિક અમૃત ” માં સમજાવી છે. તહું-પરાંત કુમે “ હું ” ને જીવ ઠરાવી તે જીવાત્મા છે એ વાત અહીં ચર્ચાવી છે. વળી જીવાત્મા અને પરમાત્માના મિલન થતાં જે અવસ્થા આનંદ અનુભવાય છે તે ધટના અનિવાર્યનીય છે, તે આ લેખનો લેખક બરાબર સમજે છે છતાં તેને અહીં શુભ્દોમાં ઉત્તારવાનો પ્રયત્ન તેણે કર્યો છે, તેમાં ડેટલે અંશે સહિણતા પ્રાપ્ત થઈ તેનો નિર્ણય વાચક પોતે કરી લેવો.

[૬]

આ “અમૃત” ને અહીં “અલોકિક” કરાવ્યું છે તે એટલા માટે કે આ “અમૃત” વસ્તુ “લૌકિક” અર્થात બજરમાં ભળતી નથી. એટલું જ નહિ પરંતુ તેનું અસ્તિત્વ સુધ્યાં નથી. છતાં સાધારણ માન્યતા એવી છે કે તે અમરત્વ પ્રાપ્ત કરાવે છે. તેવું અમરત્વ આ લેખ વાંચી મનન કરવાર્થિ-સર્વેને પ્રાપ્ત થનારં હેવાથી આ લેખનું શીર્ષક આપણે “અલોકિક અમૃત” આપ્યું છે તે યથાર્થ છે.

નં. ૪૭ શ્રીન બંગલો અંદેરી	}	મૂલાલ રજુઓડ વેદ
આદપદ કૃષ્ણ અષ્ટમી સં. ૧૩૬૨		



॥ ॐ नमो भगवते वासुदेवाय ॥

અલોકિક અમૃત.

લેખક:—મુલા રણુછોડ વેદ.



સ્વર्गમાં પ્રાતમણેને મોદક નથી ભળવાના. હેમંત ઝતુમાં અડહીઆ ખાવાના અદ્યાસી માટે ત્યાં અડહીઆ બનાવનાર કંદોધ નથી, કે નથી પોકરણું એ બનાવેલું એસાણુ અને લાત સાથે કઢી ત્યાં. સિદ્ધપુરીએનો ફંધપાક લલે ઉત્કૃષ્ટ લોજન ગણુતો હોય છતાં તે આ પૃથ્વી ઉપરજ પામીએ, સ્વર्गમાં તે નહિ મળે, માટે જેએ! મુખસ્વાહીઆ હોય અને સાથે સાથે જે સ્વર्गમાં જવાની તૈયારી કરતા હોય તેમણે આ બધું આ પૃથ્વી ઉપર ખાઈ લઈ પરવારી જવું. સ્વર્ગનું લોજન ખાદ્ય તેમજ પેય એકજ છે અને તે અમૃત. હેવો નિરંતર આ અમૃત પાન કરનારા હોઈ અમરજ છે.

આ રીતે હેવો લલે અમર કહેવાય છતાં તે અમરતા—તેમને સદાને માટે સ્વર્ગ સુખના લોકતા રહેવા હેતી નથી

અર્�ાત् આ અમરતાથી તેઓ સ્વર्गમાં સહાને માટે રહી શકતા નથી. તેની ગાંડે ખાંધી આણુંદો પુણ્ય સંચય પૂરો થતાં તેમને કુરી પાછો જન્મ લઈ મૃત્યુ લોકમાં આવવું પડે છે. ગીતાજી આ વાતને પુષ્ટિ આપે છે.

ક્ષીણે પુણ્યે મર્યાલોકં વિશાંતિ ॥

સહા અમૃતનું પાન કરવાથી હેવો અમર ખન્યા છે એ વાત અમે કહેતાં તો કહી નાંખી છતાં અમે હવે કહેશું કે, તેવી અમરતા પ્રાપ્ત સર્વ પ્રાણી છે તો મનુષ્ય તો તે અમરતાનો પ્રથમાધિકારી છે.

અમૃતનું પાન કરનારો અમર ખને છે તે અમે સ્વીકારશું, સર્વ કોઈ સ્વીકારેજ; પરંતુ તે અમૃત એઠલે જ આત્મજ્ઞાન; અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે જે સહા તત્પર અને પ્રવૃત્ત છે તે તો સહા અમૃતનાજ પાન કરે છે.

ખાદ્ય પદાર્થ આદિ જે ચાર અન્ન-ખાદ્ય, પેય, ચોષ્ય અને લેહા-તો સ્થૂલ ઢેણના પોષક છે, જ્યારે હેવના એ અન્ન અમાવાસ્યા અને પુર્ણિમા છે ત્યારે ત્રણુ અન્ન જીવ આત્મા માટે કર્યા છે. શાસ્ત્રમાં તો મર્ય મનુષ્યો માટે એકજ અન્ન ઠરાયું છે, તે એક અન્નના ઉપરોક્ત ચાર ગ્રામ તેના ખાવાની રીતિને અનુસરતા ઠરાવ્યા છે. જગત સકળમાં શાસ્ત્રોએ અને વેદે સ્વીકારલા સાત અન્ન નીચે પ્રમાણે છે—

सप्तान्नं ब्राह्मणे द्वैतं जीव सृष्टं प्रपञ्चतिम् ।
अन्नानि सप्तज्ञानेन कर्मणा जनयतिपता ॥

सप्तान्न ख्राह्मणमां ज्ञवे सर्वेषु द्वैत विस्तारथी वर्णु-
वेषु छे. पिताच्ये एटले ज्ञवे, ज्ञाने करीने अने कर्मनी
सहायथी सात अन्ने उत्पन्न कर्त्ता छे; तेनुं प्रयोग्न.

मर्त्यान्नमेकं, देवान्ने द्वे, पश्चान्नं चतुर्थकम् ।
अन्यत्विय मात्मार्थमन्नानां विनिर्योजनम् ॥

एक छे भनुप्यनुं अन्न. ऐ छे देवना अन्न. योथुं छे
पशुनुं अन्न अने खाडी ले त्रण अन्न ते पोताने माटे
राख्या. हुवे ते सात अन्न क्या ?

वीहादिकं दर्शी पूर्ण मासौ क्षीरं तथा मनः ।
वाकप्राणाश्रोति सप्त त्वमन्नातामवगम्यताम् ॥

तं हुल एटले योखा विगोरे, अभावास्या अने पुर्णिमा,
दूध, मन, वाणी अने प्राण. आ सातने अन्न बाणुवा.

आ साते अन्न जगतमां अंतर्गत छेवाथी ते ज्ञवे उप-
जन्या एम कुहेत्राय नहि एवी आशंका डोर्डि जडूर करशे
एम धारी तेनी पूर्ती नीचेना १५५२ करवामां आवेद्ध छे-

ईशेन यद्यपेतानि निर्मितानि स्वरूपतः ।
तथापि ज्ञान कर्मभ्यां जिवोऽक्तार्षीतदन्नताम् ॥

યદ્વાપિ આ (પૂર્વ ૧૬ોકેમાં કહેલાં ચોખા આદિ સાત અન્નો) સ્વરૂપમાંથી ધિશુરે રચેલા છે. તથાપિ જીવ. જ્ઞાન વડે તેમને અજરૂરે બનાવે છે (તેથી તે જીવ કૃત કહેવાય છે.)

અન્ન પ્રકરણું શાસ્ત્રોચે અનેક રીતે વર્ણાવ્યું છે, છતાં આ ચાર ૧૬ોકેમાં એક સમયે શ્રી મદ્દાંકરાચાર્યાપદ ધારી, વિદ્યારણ્ય સ્વામી પોતાના પંચદશી નામક અંથમાં આ રીતે તે અજ પ્રકરણુનો નિષ્કર્ષ જનતાને આપે છે.

વિદ્યારણ્ય સ્વામીએ સાત અજના પ્રકાર (જે મૂળમાં સપ્તાન્ન પ્રાબ્લણું નામક વેદાંત વિલાગમાં છે તે) અહીં સમજાઓયે. છે. આ સાતે અજ જીવકૃત હોઈ, તેથી તો સ્થૂલ ઢેહનું પોખણું થાય. સ્થૂલ ઢેહ મર્યા હોઈ, તેવી અનિત્ય વસ્તુને પોષનારા અજથી અમરતા ન પમાય.

ત્યારે અમૃતને શોધવું કર્યાં ? જ્ઞાન એ અજનો પ્રકાર છે. હુવે એક રીતે આપણુને અમૃતની ભાળ મળશે. અમૃતની મુખ્યા કહો કે એકની એક લક્ષણા છે, તેના પાન કરનારને અમરત્વ આપવાની. રૂઠ લાધામાં કહેશું કે અમર કરે તે વસ્તુ અમૃત. આપણે કહી ગયા કે જ્ઞાન આ અમૃતનું એક અંગ છે. અને આત્મજ્ઞાન એજ અમૃત તે આત્મ-જ્ઞાન પ્રાપ્ત થાય તો ખરું, પરંતુ તેને પચાવવા જરૂર તેવી ગ્રધળ બનાવવી જોઇએ. એવી જરૂર બનાવવા જ્ઞાનામૃતનાં

રેઝ રેઝ પાન કરવાથી આત્મજ્ઞાન રૂપી અમૃત પચાવવા ચુક્તા અર્થાત આત્મજ્ઞાન રૂપી અમૃત પચાવવા ચુક્તા અર્થાત આત્મજ્ઞાન ચર્ચાર્થ ઉગ્ની સ્વરૂપ સ્થાને પહોંચી તે જ્ઞાન, અમૃતાદિ સર્વસ્વ જેનું છે તેના ચરણુમાં એ ધરી હીધું એટલે આપણે અમર બન્યા.

અમૃતનું અસ્તિત્વ આ રીતે પ્રતિપાદન થાય છે. કેટલાક તે અમૃતને કલિપત માને છે; તો અમે કહેશું કે, તેઓ પણ સાચા છે. તે ઉક્તિનું સુદ્ધાં પ્રતિપાદન કરવાનું અમે સ્વીકારી લઇએ છીએ.

અમૃતને કલિપત ઠરાવનારે આપણુને અમૃત પ્રાપ્ત કરવાનો માર્ગ હેખાડી હીધો. કલિપનાથી શરૂ કરેલા માર્ગ કલિપના રૂપી ઘોડા ઉપર બેસી આગળ ચાલતાં વિચારણાનો ધોારી માર્ગ મળી ગયો. ત્યાંથી ચઢ્યા મંત્રણું પણે. મંત્રણુમાંથી મનન કરવાની વાટ મળી ગઈ. જેણે મનને એકાયતા આણ્ણી આપી. આ એકાયતાથી આત્મજ્ઞાનનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું. હવે અહિં સતત ઇરવાથી-નિત્યાલયાસથી આત્મજ્ઞાન મંદિરમાં પ્રવેશવાનો અધિકાર પામ્યા. તે આત્મજ્ઞાન રૂપી પ્રતિમાના નિત્ય પૂજનથી જે ઝળ મળ્યું તે સ્વરૂપ પ્રાપ્ત હોય.

ત્યારે હે વાચક ! “અમૃત કલિપત છે” એ ઉક્તિથી

અમૃત પાભવાનો માર્ગ મળી ગયો. એ સ્વીકારેલી પ્રાતિજ્ઞાનું
પ્રતિપાદન એસે કર્યું; હવે તને તે માર્ગ મળ્યો છે તો
તને અનુસરી તું અમર બની જા.

આવી રીતે અમૃત વસ્તુની ઓળખાણું કરાવી દીધી.
વળી તે વસ્તુને પ્રાપ્તિ કરવાની રીતિ અને વિધિ બતાવી
દીધી. અમર આ રીતે થઈ શકાય છે. હવે હે વાચક ! કહે
લેછએ કે, સ્વર્ગના વૈલબ લોગવતાં અમૃતપાન કરવાનું તને
ગમે કે, આ ગૃહસ્થાશ્રમ જીવન ગાળી સ્વરૂપાનંદ અનુભવતાં
અનુભવતાં મૂળ રૂપે તું જેમ અમર હતો તે મૂળ સ્થાને
પહોંચી નિત્ય બની અમરત્વ જે તારું હતું તે સ્થાને જઈ
તે સ્વરૂપમાં સમાઈ જવું તને ગમશે ?

કેમ શું ધાર્યું ? હા, સમજ્યો; તને તો ગમે છે પર-
માનંદ અને તેની પ્રાપ્તિ. અહિં ગૃહસ્થાશ્રમમાં રહીને પણ
થાય છે. અહિં તે સ્વર્ગનાં વૈલબો, અપ્સરાનાં સંગીત,
અમૃતનાં પાન ડોને ન ગમે ? તેથું બધું ગમે તો અરું
છતાં જ્યારે પુણ્ય સંચય વપરાઈ જાય અને પરિણામે
સ્વર્ગમાંથી પડી મૃત્યુ લોકમાં આવવાથી થતો આધાત અને
લાગતો પણાડ તને નથી ગમતો, એ તારું કથન યથાર્થ છે.
તારો આ નિર્ણય અને એવીજ તારી જે લાવના છે તે
જરૂર તને જ્ઞાનમાં પ્રગતિ કરાવશે.

હવે આપણે મૂળ રામ ચરિત્રમાં આ સ્વર્ગનાં જેવાંજ સુખ આપનારી રામકથા તરફ વળશું તો જ્ઞાન દિશામાં પ્રગતિની સાથેસાથ લક્ષ્ણિતી પ્રબુ કૃપા પ્રાપ્ત થશે અને તે ખંનેનાં મિલનથી આત્મજ્ઞાન તો કરામલકવત્ત મુઠીમાંજ નિરખશું. રામ કથા આ પ્રમાણે સન્ત સલા અને સાથે સાથે સ્વર્ગ સમાન ઠરે છે તે આપણે તુલસીદાસની ઉક્તિમાં અહિં ઉતારશું.

રામ કથા સુરધેનુસમ.....વળી તે સન્ત સમા તથા સુરલોકસમ કૌન સુનૈ અસ જાની ॥ આ રામ કથા સન્ત સલા અને સ્વર્ગ જેવી છે એવું કોઈએ સાંલઘણું નથી. તો જાણે તો કયાંથી ? છતાં ખરી રીતે સર્વે પ્રબુકથા એવીજ છે.

અહીં સન્ત, સાધુ, સત્સંગ, અથવા સાધુસમાગમ, સન્ત, સલા, સ્વર્ગ અને તેવાં સવિસ્તર વર્ણન, અમૃત, અમૃતનું રૂપ, અમરત્વ, અમૃત પ્રાપ્તિ કરવાની રીતિ એ અમૃતનાં સામ્ય એ બધાની યથાર્થ સમજુલ્ટી અને ઉકેલની સમાપ્તિ થાય છે. ઉપરોક્ત સર્વે લાલ પ્રબુકથામૃતના નિયમીત પાન કરવાથી મળે છે.

એવું કલ્યાણકારી પ્રકરણ અહીં સમેટી પૂર્વું કરશું.

આ રામ વસ્તુ શું છે ? સાધુ સન્ત તથા સન્ત સમાગમ વળી પાર્વતી દૃષ્ટિએ રામ અને રામકથા મહિમા;

રામાયણનો અનુક્રમ, રામાયણનો આધ્યાત્મિક વિલાગ પ્રક્રિયા અને તેનો ઉકેલ, બાળકો અને સ્વીચ્છાને ચુક્તા પ્રત્યુત્તર આપવાની આવશ્યકતા; પ્રભુ લજ્જનથી વિમુખ મનુષ્યની સ્થિતિ પ્રભુ પ્રેમાર્થ અંગ જેનાં પ્રવૃત્ત નથી તેને પ્રાપ્ત થયેલી ઉપમા; રામકથાનો માર્મિક વિલાગ. આહિ વિવરણું થઈ ગયા. હું રામકથાનું સાધન ઇપ સમજુએ.

રામાયણ

રામકથા માર્મિક વિલાગના અંતિમ ભાગમાં અમૃત એ કદ્વિપના જન્ય વસ્તુ છે એમ ડોર્ધ કરે તો તે “કદ્વિપિત અમૃત સંશોધી સુદ્ધાં તે અમૃત પાન જન્ય અમરત્વ પામવાનો માર્ગ મનુષ્યને મળી જય છે અને પરિણામે તેવો મનુષ્ય અમર થાય છે. તે પણ સમજાવ્યું. કદ્વિપના અશ્વ ઉપર સવાર થઈ જાણું વિચારણાના પ્રદેશમાં જય છે. પરંતુ વિચારણાના પ્રદેશમાં તે ત્યારેજ જય, કે જયારે પ્રારંભથીજ તેણે પોતાના આ કદ્વિપનાના અશ્વને ચુક્તા દિશામાં હંકચો હોય, જાણું તો ચુક્તા દિશામાં પ્રેરનાર તો પ્રભુ છે અને તે પ્રભુ કૃપા શુદ્ધ લાવનાથી આપોઆપ પ્રાપ્ત થાય છે.

. હું વિચારણા ક્ષેત્રમાં પહોંચ્યા પછી જો તે સાચે માર્ગ જીડાને હાક્કિ રાખે તો મંત્રણા આવે છે. આ પ્રદેશમાં તેને

સજજનોનો સાથ ધળે છે અને સંવાદને પરિણુમે મનન ક્ષેત્રને માર્ગે આ સુસુક્ષુ ચઢે છે. આ મનન ક્ષેત્રમાં તે પોતાનાં કલેપના અશ્વને વિદ્યાય આપી હેઠે. કારણ કે હવે આ ખ્યાલી અર્થવની તેને નથી પરવા કે નથી આવશ્યકતા. આ મનન ક્ષેત્રમાં કેટલોક કાળ સ્થિર થવાથી તેને એકાશ્રતા પ્રદેશનો પથ પ્રાપ્ત થાય છે. એ એકાશ્રતા પ્રદેશને તે ધૈર્ય રાખી ધીરજનો સાથ સાધી જેસે છે. તેની પાત્રતા-ચોભ્યતાના પ્રમાણુમાં આ કાળ હુક્કે કે લાંબો રાખવો પડે છે.

એકાશ્રતા અનુકૂલ થતાં તે તેને જ્ઞાનની દિશા દર્શાવે છે. આ જ્ઞાન દિશામાં કેટલોક કાળ વિચરતાં વિચરતાં તે આત્મ-જ્ઞાન મંહિરની વાટે ચઢી જાય છે. “આત્મજ્ઞાન” એ સ્વરૂપ મંહિરનો રસ્તો દેખાડનારી આ પ્રદેશની અધિકાતા દેવી છે. આ માર્ગે તે જ્જાસુ આગળ ને આગળ ધરે જાય છે, ત્યારે અર્ધ રસ્તે તેને “વિજ્ઞાન દેરી” સાંપડે છે. આ વિજ્ઞાન દેરીમાં એક પૂજની રહે છે. કેટલાક તેને પંડિત સંજા આપે છે.

ઇંગ્રેઝુમાં તેને Oriental Professor ઉપાધી લગાડે છે. એ ગ્રેફેસરો તો મોટા મોટા પગાર પામે તોજ વિજ્ઞાનમાં સાથ પૂરે અને પૂરાવે. આપણા ઉગમણુના વિજ્ઞાન ક્ષેત્રમાં તો જ્જાસુએ ખીસ્સામાં જ્જાસા રૂપી દ્રવ્ય રાખ્યું હોય તે પૂરતું ગણ્યાય. જ્જાસુ આ વિજ્ઞાન ક્ષેત્રની વિજ્ઞાન મહા-

વિદ્યાતથમાં થોડાજ કાળમાં વસી સાધુ સંતના સાથમાં આત્મજ્ઞાન દેવીની પૂજનાં વિભિ શીખી જય છે. અહિં તે આત્મજ્ઞાન મંહિરનો અધિકારી, આત્મજ્ઞાન સંપ્રદાયનો ઉપાસક અને આત્મજ્ઞાન દેવીનો પૂજારી એવી ત્રણુ પદ્ધીઓ પામે છે; આ પદ્ધી પ્રાત મનુષ્ય હોય તેજ આત્મજ્ઞાન પ્રદેશમાં પ્રવેશ કરવાનો અધિકાર પામે છે. આવી ઉપાધી-વાળાને હુવે ત્યાં કોઈ રૈકૃતું નથી. વળી વગર પૂછે તેને જે મળો તે આત્મજ્ઞાનપુરની વાટ બતાવે છે. આવી સવળતા પામીને જોતજોતામાં તે આત્મજ્ઞાન નગરમાં વહેલો વહેલો પહેંચી જય છે, તે પુરમાં પ્રવેશતાંજ, તે પુરવાસીઓ લાંખા સમયનો તે પરિચિત મિત્ર હોય તેવા સદ્ગ્લભાવથી તેનો સતકાર કરે છે. આ પુર અને પુરવાસીઓનો સાથ તેને આનંદમળ બનાવે છે.

આ નવા આગંતુકને જ્ઞાન કુંડમાં સ્નાન કરાવી, શ્વેત એ વસ્ત્રો તેને આપે છે. એક પહેરવા અને એક એડવા. અહિં વર્ણ અથવા લેદ વા રંગને નથી અવકાશ કે નથી સ્થાન, અહિં અદ્વ્ય અને અદ્વૈતનીજ હાક સંભળાય છે. દેવીના મંહિરના ધુમરમાં ગુંજતો ધ્વનિ સુદ્ધાં તેવોજ અદ્વ્ય અને અદ્વૈત લાવના ધૂને ચઠાવનારો જ સંભળાય છે. આ ધ્વનિમાં મસ્ત બનેલા લુજાસુ, ના-હુવે આપણુથી તેને લુજાસુ ન કહેવાય કારણુ હુવે તેને ત્રણુ ડીશ્રીઓ મળી છે

તેથી તેવા—આત્મજ્ઞાન હેવીના ઉપાસકને આત્મજ્ઞાન હેવી મંહિરમાં સાથે લઈ જાય છે, આત્મજ્ઞાન હેવીના ઉંખરે દ્વાર-પાળ પૂછે છે કે “હે અંધો” તારા સ્મરણુ પટરૂપી ખીસસા ખાલી કરી નાખો. એ સ્મરણુ પટના ખુણે ખુણુ શોધી, પાપ પુષ્ય, એવી ભાવના, સારં, નરસું કે અજવાળું, અંધારં, અજ્ઞાન, જાનાદિ દ્વારો, ચાર વર્ણ અને ચાર આશ્રમ, તેમજ ધર્મ, અધર્મ, દ્રોપ, લેહો, શવ, વૈષણવ, જૈન, બૌદ્ધ, ઈસિાઈ, મુસ્લીમાહિ ધર્મ લેહ, સંપ્રહાયલેહ, વાડા પાડા આદિ વિષ-વાદ એવું એવું જે કાંઈ સ્મરણુ પટના ખુણે ખુણુ ખોળી તે સર્વેને જાનાભિકુંડમાં હોમી હીધા, તેની લસ્મ હું નીરખું છું; તેવી લસ્મને સુદ્ધાં હું તિલાંજલિ દઉં છું એવી શુદ્ધ અને પ્રખર ભાવના ભાવો. તે ભાવના ભાવી ? ”

આવા દ્વારપાળના પ્રશ્નનો પ્રત્યુત્તર શુદ્ધ રજક ઘંટઠીના રણુકારવત્ત તુરતજ દ્વારપાળને મળે છે એટલે તેને આ મં-હિરમાં પ્રવેશ કરવા દ્વારપાળ નીચ્યા નમી ઉલો થઈ, એ હાથે નમસ્કાર કરી કહે છે કે “આવા સંસ્કાર અને સતકારની ભાવના સુદ્ધાં આજે છેલ્દી સમજી કરી તે મનમાં યાદ નહિ. રાખતા હો ! એ વિવેક અને એવાં સંસ્કારને સુદ્ધાં તમે ઝેંકી હીધાં છે એવી ભાવના દફ રાખી, હુવે તમે આ હેવી મંહિરમાં પ્રવેશો. દ્વારપાળના પહેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપ-

વામાં રજ જેટલો વિલંબ કે તૃણુ જેટલી ધૂળરી જે નવા આ-
ગંતુકને આવી હોય તો સાથે આવેલ આત્મજ્ઞાન નગરના તેના
સાથી પોતાની મહુલીમાં તેને લઈ પાડ પઢાવી પ્રવીણ કરી
કુંક દિવસોમાં ફરી દ્વારપાળના સાનિધ્યમાં તેને ખડો કરે છે.

હુવે તેવા આનંદમજન આ સંપ્રદાયના ઉપાસકને આત્મ-
જ્ઞાન દેવીના કમળરોકા સિંહાસનની પૂજા કરાવે છે. તેની
આ પૂજા છેલ્લી છે. આત્મજ્ઞાન દેવીના ચરણુમાં તેનાં સર્વ
સાધન, સંપત્તિ, જ્ઞાન, વિજ્ઞાનાદિ સર્વે સમર્પણુ કરી હે છે,
સાથે આવેલા તે પુરના તેના સાથીઓ તે દેવીની પૂજા કરાવે
છે, તે પૂજા વિધિમાં નથી જોઈતાં પુણ્ય, નથી ત્યાં આવ-
શ્યક્તા અણીલ શુલ્કાદની, અગરભની કે ચંદનની અર્ચાની,
અહીં પ્રથા નથી, હાથજોડ તો મંહિરને ઉંખરે દ્વારપાળની
પાસે જ તેને ઠાલવી નાખી હોય છે.

ત્યારે આ પૂજા વિધિ કેવી હુશે ? હે વાચક ! તારે તે
જાણુવી છે ? જાણુવી હોય તો તારે પ્રતિજ્ઞા કરવી પડશે કે
“આજથી હું તે મારો પરવરીશ ” હા, તને તારા ઐહિક
વ્યાપાર કરવાનો અવકાશ અને છુટ રહેશે; તે તો આ દેહ
રૂપી નાવડાને ટકાવી રાખવા. તેમ કરવા છતાં મનમાં ગોખી
રાખ, હૃદયમાં ગાંડ ખાંધ કે “ હું આ દેહ નહિ પણ આ
દેહમાં વસ્તો જીવત્મા છું. હું શિવ છું અને જીવલાવ ટળતાં

મુનઃ શિવ બની જઈશા.” ટીક, એ પણ ટીકજ થયું કે તેં
તેવી પ્રતિજ્ઞા સ્વીકારી અને લીધી; તો આત્મજ્ઞાન દેવીની
પુનર્વિધિ તને હેખાડું છું.

નવો આગંતુક, આત્મજ્ઞાન દેવીની સન્મુખ ઉલ્લો છે. તેના
ચક્ષુ અને દેવીનાં નેત્ર એક થયાં. મુખથી કંઈક મનમાં તે
લવે છે, તેનાં હેઠળ ખીડાયાં. લવાં ઉંડા વિચારની સાક્ષી પૂરે
છે. હુવે તેની આંખ સજળ થઈ. આંખ ભીની છતાં તે હૃથ
ઉપાડી લુતો નથી. તે કંઈક ઉંડા વિચારમાં ભરે છે. હુવે
ન્યેયું તેણે નિશ્ચાસ લીધો. તેની મુખ્યચર્ચા વ્યક્ત કરે છે કે
તેના હૃદયનો લાર હુણવો થયો. આ મુખલાવ હુવે પલટાણો.
હુવે તો ચોકખું જણ્ણાય છે કે તે બોલતો નથી, તેનું મુખ
ઉધડયું નથી છતાં જો તને અને મને સમજાય છે કે તે અંત-
ગૃત શું કહે છે; લે....હા....આ....આ....સ....ખડુ લટક્યો,
ખડુ લટક્યો ફૂર ફૂર લગ્યો હોા, જયારે આત્મકૃપા થઈ ત્યારે
આત્મા પ્રસન્ન થયો. આત્માની પ્રસન્નતા પ્રાપ્ત થતાં એક પણી
એક મૂળ સ્થાને પહોંચવાના માર્ગો મળતા ગયા. ને અંતઃસ્કુ-
રણાને લીધે હું અહીં આત્મજ્ઞાન મંહિર સુધી આવી પહોંચ્યો.

હે વાચક ! સાવધાન ! ખરાખરીનો આ મોકો છે તે શું
કરે છે તે બરાબર નિરખ. શું કહે છે તે બરાબર સાંલળ.
સાવધાન ! સાવધાન ! ! સાવધાન ! ! !

ત્યાં શૂન્યકાર વ્યાપી રહ્યો; ક્ષણેક અંધકાર પણ છાઈ રહ્યો, લેખક અને વાચક સ્તબ્ધ થયા. કાનમાં શૂન્યકાર, આંખે અંધકાર, જીલ તો તાળવે ચોંટી ગઈ, પગ થંભીને થાંસલા થયા, હાથ પક્ષધાતથી ઘવાણું. નાક પોતાનો શાસેચ્છવાસ લેવાનો ધર્મ ભૂલી ગયું. કહે કે બંનેના સર્વ અંગો, પાંચે કર્મનિદ્રિયો અને પાંચે શાનેનિદ્રિયો, જડવત્ત બની ગયા. આ સ્થિતિ ક્ષણું અર્ધક્ષણું રહી હશે એવામાં તો:-

આગંતુક અને દેવીની આંખો એક થઈ ગઈ. બંનેના સુખ હરખાયાં, આકર્ષાયાં, આકર્ષાઈ આકર્ષાઈ એક થઈ ગયાં. તે એક થતાં અનોખો પ્રકાશ થયો, પ્રકાશ વધતો ગયો, લેખક અને વાચકની આંખોથી તે ન સહેવાયો. લેખક તો આત્મખળ સાધી જેમ તેમ આંખો! ઉધાડી રાખી શક્યો, પરંતુ વાચક સહેજ ધૂજ્યો, તેને હાથેથી ટેકલી ખડો રાખ્યો. પડખામાં ચુંટી દઈ તેને સાવધાન કર્યો. પ્રકાશનો અંબાર વધતો ગયો. વધતો જય છે. જાકમ જોળ જ્યોતિ જગ્યા અજવાળા અનોખા છે. પ્રકાશ આંખો જીરવી શકતી નથી. આવો અતિશય પ્રકાશ છતાં વાતાવરણમાં જરા જેટલી પણ ઉણુતા નથી. આવું તે વાતાવરણ છે સુખ સ્પર્શી.

અરે! અરે!! અરે!!! આ શું? વાતાવરણ સુખ-સ્પર્શી તો કહી દીધું, પરંતુ તેવે! સ્પર્શ રહેરગ અને રૈમે

રૈમ ચેતન અપ્રો રહ્યો છે. ચેતનની સાથેસાથ તે સ્પર્શ અતિ ગમતો બને છે.

હે વાચક ! સાવધાન. તું શું સાંલળે છે ? આ રણુકાર કેવો કર્ણપ્રિય છે ? તે વ્યકૃત અને સ્પષ્ટ તો છે, છતાં તેમાં નથી કઠોરતા કે નથી કદુતા, તે ધ્વનિ આનંદદાયક હોઈ, આ આખા જીવનમાં તેં તેવો રણુકાર કદિ સાંલજુયો નથી. પૂર્થી પરના સંસ્કારી અને સુનિયમિત સંગીત કરતાં તે અનેં છે. તેમાં સંભાળતા ડેકા લેવાના તાલ, ચુક્તા યતિ, આરોહ; અવરોહ; મુર્ચ્છના સર્વો સ્પષ્ટ સમજય તેવાં છે, અરે લાઈ ! જેયું, જેયું, તે ધ્વનિ, સ્વ અલિનય કરે છે—અલિનય કરતો લાસે છે, અલિનય, કહો કે એવો અલિનય ગુણિકા ન કરી શકે; સ્વર્ગની અસરાઓથી તે નજ થાય, રંલા અને ઉર્વશી આ અલિનય નિરખી તે અદૃશ્ય વસ્તુના અલિનયને હુથ જેડી પ્રણામ કરતાં કરતાં દંડવત્ બની લાંખી થાય છે. લાંખી થઈ સુતાં સુતાં પણ આંખો તો ઉધાડી રાખે છે. તે ચર્મ ચક્ષુ તો છે બંધ છતાં તેને તે અનેરો અલિનય ગ્રલક્ષ્ય વ્યકૃત થાય છે.

હે વાચક ! તને તે દેખાય છેને ? મૂર્ખ ! તારી આ કોડા સરખી આંખ બંધ કર, તોજ તે અલિનય નિરખશે. ધ્વનિ તો કર્ણની તૃસુ કરે પરંતુ આત્મગાનનો ધ્વનિ તો

અક્ષુ ગોલાકમાં પ્રવેશી અંતરના પટ લેદીને દૃષ્ટિ દૈવીનું
દૃશ્ય બની આવા અનોખા અલિનય દર્શાવે છે.

હે વાચક ! હુવે તો ભાઈ જગૃત થા અને સૌરલનાં
સુવાસ લઈ લે, બાપુ ! સાવધ થા, કરી આ મોક્ષો નહિં
આવે હો. આ તો આત્મજ્ઞાન, દૈવીની આત્મપૂજા કરે છે
તે સમયેજ આવું આવું અનુભવાય છે. આ સુવાસ ન હોય,
સ્વર્ગમાંથી પારિણતક શ્રીકૃષ્ણે આણી રૂક્ષિમાણીને આંગળો
રોષ્યું હતું તે દૈવી વૃક્ષનાં પુણ્ય સુદ્ધાંની અને તે પુણ્ય
આવી સૌરલ નથી આપતાં હો. આ દૈવી-ના, ભાઈ-ના,
દૈવી નહિં કહુંએ ! આ તો આત્મનક પૂજા. આત્મા આત્માનાં
પૂજન કરે લ્યાં આવોજ વિધિ હોય.

આગંતુક તો આત્મજ્ઞાન દૈવીની પૂજા સંકેતતા જગુાય
છે. આ પૂજામાં પૂજારી અને પુજય માત્ર સામસામા મીટ
માંડી સ્થાનિત છે; છતાં આ દૃશ્ય, આ ધ્વનિ, આ સુવાસ
આદિ સર્વે થતાં જય છે, સમજય છે, અનુભવાય છે, અનુ-
ભવ સિદ્ધ વાતો ખોટી ન હોય. તને ખરી કરવી એ તો
વ્યક્તિગત વસ્તુ છે. તેવાં રત્નને પાંચીકો ગાણી ફેંકી દેનાર
તેમ કરવા સુખલ્યારી ધરાવે છે. સુખલ્યાર થવું ધણુને ગમે
છે તેથીજ હુંનરે નવસેં નવાણું આપ અખલ્યારી અજમાવી
સુખલ્યાર બની આવા રત્નો ધુળમાં રોળી નાંખે છે. સેણીને

પછી રૂવે છે. હે વાચક ! તેવા હુજર માંહેલો એક તું થને. ભાઈ ! નવસો નવાણું માં નહિ લગતો હો.

આવી રીતે લેખકની અને વાચકની દરે દિનિયો પ્રસન્ન થઈ ન થઈ ત્યાં તો તે પૂજારી હસ્યો, દેવી હસ્તી, અભિનનો ભભૂકો ઉક્યો, અભિ છતાં તેમાં ઉષણુતા નહિ પરંતુ સુખ સ્વપર્શી હતાં.

પૂજારી અને પૂજન્ય દેવી હળુ હળુ અરસ્ટપરસની સામે આવતાં લાસે છે; ડગે ડગે હર્ષાય છે, આગંતુક દેવીમાં એ દૃશ્ય બને છે. દેવી તેને પોતાના અંતરમાં લપેટી તે આગંતુકના હૃદયમાં મંહિરસ્થ દેવ આત્માના ચરણુમાં ખાડુ કાળજીથી પદ્મરાવી પાછલે પગે હુળવે હુળવે અતિ હુળવે પગે પાછી હુઠે છે.

આત્મા પ્રસન્ન વદને આગંતુક ઉપર અમિદાદિ ઝેંકાંજ તેના ચરણુમાં પડેલા આગંતુકમાંથી તેવીજ જ્યોતિ ઝરી હસે છે, હર્ષાતાં હર્ષાતાં આત્મામાં જીવાત્મા લીન થઈ જાય છે. હુવે તે જીવાત્મા નહિ પરંતુ પ્રત્યક્ષ શિવ બની ગયો છે. આત્મજાન દેવી હૃદય મંહિરને ઉંબરે ઉલ્લી ઉલ્લી છાની છૈાની આ બધું નિરખે છે. અરસ્ટપરસમાં તેમને લીન થતાં જોઈ તેનો અંતરાત્મા પ્રસન્ન થાય છે. તેના હુથ અનાયાસે લેળા થઈ આશીર્વચન ઉચ્ચારતા લાસે છે. તેના મુખ-

માંથી હર્ષેહિગાર નીકળે છે કે, હા....આ....શ એક વધુ જીવને
શિવ ખનાવવાનું સુભાગ્ય મને પ્રાપ્ત થયું.

આ પૃથ્વી ઉપરનું અમૃત, જે આ જીવને શિવ ખનાવીને
અમરત્વ અપ્યું.

ॐ સદગુરૂદા



તુલસીદાસજી લિખિત વિવેકમાળા



આત્માનો અધિકારી કોણું ?

જે મનુષ્ય શાન્ત, દીન, ઉપસ્ત, તિતિક્ષુ અને સમા-
હિત થાય છે તેજ મનુષ્ય આત્મામાં આત્માને નિરખે છે
અને તેજ બધાનો આત્મ રૂપ બની જય છે—ઉપનિષદ્.

નરકનો અધિકારી, કોણું ?

જીવા સાથે દ્રોહ કરીને જે પોતાના શરીરને પોષે છે,
તેવો ભાણુસ તેવા તે શરીરને અને પાપકર્મથી સંચિત
કરેલા ધનને અહિંજ છોડીને, એકલો અટુલો—હા, પણ સાથે
વાટ ખર્ચ માટે પાપનો પુંજ સાથે લઈને અન્ધકારમય નર-
કમાં પ્રવેશ કરે છે.

—શ્રીમહંલાગવત.

ખરો શુરવીર કોણું ?

મનુષ્ય મનુષ્યને હરાવે અર્થાત એક મનુષ્ય ખીલ ઉપર પેટાના શૈર્યથી જીત મેળવે તે ભલે શુરવીર ગણ્યાય, પરંતુ ખરો શુરવીર તો એજ છે કે, પ્રાણી માત્રના શત્રુઓને છે તેને વશ કરે. જેણે કામ, કોધ, લોલ, મોહ, મહ અને મત્તસર એવા છ-શત્રુઓને જીતી કીધા છે તેવો પુરુષ, ધર્થરની એવી લક્ષ્ણ કરે છે કે જે દ્વારા તેને માટે લગવાનમાં પરમ પ્રેમ ઉમજ થાય છે.

—મહાભારત

કુદુંખ મેળો.

અમારો પુત્ર, અમારી દારા, અમારો પતિ આદિ સગ-પણુના નાતામાં લોકો રાચે છે. વળી તેમાંથી કોઈ સગાં-વહુલાનું મૃત્ય થતાં નહાનાં બાળકવત્ર રોવા અને કુટવા મંડી જય છે. એ અનુભવ તો આ સંસારમાં સાધારણું છે; છતાં દેવષિં નારદનાં વચનો જેણે હૃદયમાં ગોખી રાખ્યા છે તેને આ કુદુંખનાં સુખ હુઃખ બાધતાં નથી. તે વચનો આ રહ્યાં:—

ને રીતે પાણીના પ્રવાહના વેગમાં એક સ્થાનની રેતી કણું કણું થઈને વહી જય છે અને હુર હુર આવેલી અત્યાર સુધી અદગ અને અપરિચિત રેતીનાં કણોં સાથે-જ્યાં

અવરોધ આવે ત્યાં એકહી થાય છે; તેવી જ રીતે કાળ-સમય
—થી ધકેલાયલાં પ્રાણીઓ ધડીકમાં વિચોગ અને ધડીકમાં
સંચોગ લોગવે છે. કુદુંબ મેળો પણ આવોજ હોય, તેના
વિચોગ સંચોગની પરવા શાણો મનુષ્ય કદિ નથી કરતો.

—હેવિં નારદ.

મોક્ષ પ્રાપ્તિનાં સાધનો કયાં ?

સરલતા, કર્તવ્ય પરાયણુતા, પ્રસન્નતા અને જિતેન્દ્રિયતા
તથા વૃદ્ધ પુરુષોની સેવા એ સાધનોથી મનુષ્યને મોક્ષની
પ્રાપ્તિ થાય છે.

—લક્ષ્મિ પ્રહુલાદ.

નિર્ભય કેણું ?

જે મનુષ્યથી પ્રાણી માત્ર નિડર રહેતાં હોય; વળી જે
પોતે અધાં પ્રાણીઓથી નિડર રહે છે—(આવું તો લારેજ
અને કે પોતાનું તે મનુષ્યનું જીવન સર્વાંશે નિર્દેખજ હોય;) તેવો મનુષ્ય મોહુથી છુટ્યો છે અને તે સર્વથા સર્વદા અને
સર્વત્ર નિર્ભય જ છે.

—લગવાન વ્યાસ.



॥ॐ नमो भगवते वासुदेवाय ॥

ક ર્મણો ગ



લખક
ભૂતાજ રાજુલોહ વેદ

પી ઠિ કા

યોગ શખદથી રીતિ-વિધિ માર્ગ કે સંપ્રદાયનાં સૂચન થાય છે. યોગનો સાધારણ અર્થ પાનાજ દર્શિત યોગમાર્ગ છે. આ યોગમાર્ગ અને હઠયોગ એ બજે લિન લિન છે. યોગમાર્ગ જ્યારે આત્મપ્રાપ્તિ કે આત્માનંદ મેળવવાનો ધ્યેય હોય છે ત્યારે હઠયોગમાં તો દેહની પુષ્ટિ અને દેહ તુદ્ધિકી ધ્યેય ધારવામાં આવે છે. પહેલામાં જ્યારે આત્માને ઓળખી જન્મ ભૂત્યુની પરંપરામાંથી દૂષ્ટવાની ધૂંઘરા અર્થ આડૃથીતવ છે; જ્યારે ભીજમાં આ દેહમાં વસી અજર અને અમર થવાની તીવ્ર ધૂંઘરા લરી છે, દેહ તો જન્મેલો હોઢને નાશવંત તો છે પરંતુ હઠયોગીનાં પરાક્રમ તો નાશકાળને બહુ લાંબે સુધી હઠાવે છે. ચાંગદેવ તેવા સિદ્ધ પુરુષ હતા; તેને માટે એવું કહેવાય છે કે તેણે પોતાનો દેહ આવી સિદ્ધથી અગીઆરસો વર્ષ સુધી ટકાવ્યો હતો; અને જ્યારે સદ્ગુરુ નિવૃત્તિ-નાથની અનુભાવુકતાધ્યે પ્રલુના અવતારદ્વારા જ્ઞાનદેવની પ્રેરખુથી તેને આત્મજ્ઞાન આપ્યું લારે તે સિદ્ધ પુરુષને સિદ્ધ તરરૂ અલાન આપ્યો.

આવા યોગ અનેક છે, તેમાં ભગવદ્ગીતાન્તર્ગત શાનયોગ, અક્રિતયોગ, સંન્યાસયોગ, અધ્યાત્મયોગ, રાજવિષયોગ, રાજગુણયોગ, કર્મયોગાદિ મુખ્ય છે. એ બધા યોગના દળ કે લાભ બિજ બિજ છે. જ્ઞાન પણ આપણે એટલું કહેશું કે કર્મયોગ બધા એક વક્તિથી એક જીવનમાં રૂધ્યાતાં નથી. અધિકાર, જ્ઞાન, કે શક્તિ અને સાધનાનુસાર જેને જે અનુકૂળ લાગે તે યોગથી કે માર્ગથી મનુષ્ય પોતાનું ધ્યેય સમજ લે છે. શ્રીકૃષ્ણ પરમાત્માએ આ બધા યોગ વર્ણન કરી તેના લક્ષણ્ય સમજાવીને તેના અને તદાન્તર્ગત્કાશ્રમ અને સાધન દેખાડ્યું છે.

એ બધું કહીને આ નટવરે અર્જુનને બોધ આપી કહ્યું છે કે, સર્વયોગમાં શ્રેષ્ઠ તો કર્મયોગ જ છે. કારણ કે સંસારમાં રહી દાન, સહાય આદિ પરોપકારી કાર્યો કરતાં કરતાં સ્વામીશ્રી વિવેકાનંદને રાજયોગ ઠરાવ્યો છે એવા કર્મ-યોગની મહત્તમ જનતાના લાભાર્થી અર્જુનને સમજાવી છે.

આ લખું લેખમાં તે કર્મ-યોગનું સ્વરૂપ અતિ સંક્ષેપમાં સમજાવ્યું છે. તે વાંચી તદાનુસાર વર્તનથી જો ડાઈ પોતાની ઉત્તતિ કરી લે તો લેખક પોતાનો હેતુ સિદ્ધ થયેલો સમજશે.

નં. ૭૭ મીન બંગલો
અંદ્રો }
કુદ્દાદ્વારા કૃષ્ણપક્ષ અષ્ટમીશાસ્ન. ૧૯૯૨ }

મૂળાલ રજીઓડ વેદ



“કર્મ-યોગ.”

અર્જુન ! મેં તને આ શ્લોક “ યજ્ઞાર્થકર્મણો ઽન્યત્ર ” તને આ અધ્યાયમાં ત્રીજે સમજાયેલે. જ્યારે અહીં હું તને કહું છું કે, જ્યાં યત્નાં નામ માત્ર આવે ત્યાં વિષણુની પધરામણી આપોઆપ જ થઈ જાય છે, તેવાં યજ્ઞાર્થ ન હોય તે બધાં કર્મો બાધક અને અપ-વિત્ર છે. ત્યારે હવે વધુમાં જાણી લે કે, તે યજ્ઞ હું પોતે જ છું અને હવે તું બની જ તત્ત્વજ્ઞ, અને તારાં સર્વે કર્મો તું મારામાં જ અર્પણ કરી હે, એવું હે પૃથ્વાના મુત્ર ! તું જાણી લે. એવું તે સગુણુષ્ટક્ષ-શ્રીકૃષ્ણ કુન્તીના મુત્ર અર્જુનને કહે છે. તું ચુદ્ધ લલે કર છતાં તે ચુદ્ધ-કર્મ અને અન્ય સર્વે કર્મોનાં ઈશ્વરાર્પણ તો અવર્થ કરજે જ, એવાં કૃષ્ણાર્પણથી સ્વધર્મ સચ્યવાય છે. માટે હવે ભીજુ ટકટક છોડીને ચુદ્ધ કર.

હે પાર્થ ! એક વખત જ્ઞાન પ્રાપ્ત કર્યો પણી પણું

તારે લોકસંઅહાર્યે કર્મ તો અવશ્ય કરવાં જ, તેથી જ મેં તને આ રીતે કર્મ કરવાનું કહું: કેમકે અધ્યાત્મ ચિત્તથી અર્થાત् એકાશ બનીને (સર્વત્ર આત્મા વ્યાપીને રહ્યો છે એવું સમરણ રાખીને) આશા, ભમતા રહિત ખાનીને એટલે કે નિષ્કામ થઈને અને કર્મવિષયનું અલિ-માન છાડીને તું કર્મ કર એવો મારો તને આથહ છે. જ્યારે તો આશા અને ભમતાને ફર કરી દીધી એટલે તારી સામે “ હું પણ ” માથું નહિ ઉપાડે. ત્યારે કઠા-ભાવ તે કર્મમાં તને નહિ રહે.

જ્યાં આવી આશા ભમતા રહિતતા ત્યાં અકર્તૃતા આવીને પ્રત્યક્ષ ઉલ્લી રહેશે; આવે મોકે કર્મમાત્રમાં પ્રદૂષતા પ્રવેશ કરશે. જ્યારે કર્મનો પલટો પ્રદૂષમાં થયો કે તરત જ પ્રદૂષાની પ્રાપ્તિ થઈ ગઈ એમ સમજ; એનું નામ જ અધ્યાત્મ અને તે સ્થિતિ કહેવાય છે. આધ્યાત્મિક; એવો પ્રદૂષાની થયા પછી પણ તારે જે કંઈ કર્મ તું કરે તે સર્વો કર્મો મને અર્પણુ કરવાં; અને હું સગુણ અને સાકાર પ્રદૂષ છું એ વાત તારે કહિ પણ ન ભૂલવી.

અજ્ઞુન ! એક વખત અહંકારનો ત્યાગ થઈ ગયો ત્રો ત્યારપછી આવાં આ કર્મને કૃષ્ણપર્ણુ કરવાનો સંસ્કાર

આપોઆપ જામણે, તદ્વેં તારે ડગલે અને પગલે કર્મ માત્ર મને અર્પણું કરવાં.

કર્મ-કૃષ્ણપર્ણ મહિમા—હવે હું, તને કૃષ્ણપર્ણ-મહિમા સમજાવું છું; તે હું લક્ષ દ્ધિને સમજ. એ મર્મ સમજયા પછી સર્વ કર્મ પ્રક્રાર્પણ કરવાથી કર્મમાત્રમાં પ્રત્યક્ષ પ્રક્રાર્પણ વ્યાપી રહે છે અને તેથી તે કર્મચરણ કર્મ નહિ પરંતુ પ્રક્રાર્પણ એવ બની જાય છે એટલે તજજન્ય આનંદ અન્ય સર્વ ઐહિક આનંદને ઢાંડી હે છે. અર્જુન ! જે આ રીતે કર્મનાં કૃષ્ણપર્ણ કરે છે તે સગુણસાકાર પ્રક્રાનો દાસ બને છે. જ્યારે તે પુરુષ મારે દાસ કહેતાં અનન્ય લક્ષા બની ગયો, ત્યારે મારે તેના વિષે ઉદ્ઘાસ ન જ રહેવાય, મારાથી તેના સુખહુઃખ, અગવડ કે સગવડ સમયે તટસ્થ ઉલા રહી જોયા ન જ કરાય. હું તેને યોગસિદ્ધિને માર્ગ મર્કી; જરા પણ પ્રયાસ કરવા નહિ દઈ અને તેને આપોઆપ તે યોગસિદ્ધિ પ્રાપ્ત થાય એવું કરી દઈશ. હે પાર્થ ! ચાથા અધ્યાયમાં મારા સ્વભુષે હું કહીશ ક, “ બ્રહ્માર્પણં બ્રહ્મહવિ ” અર્થાતું પ્રક્રાને અર્પણ કરેલાં સર્વે કર્મ બ્રહ્મહવિ કહેતાં પ્રક્રાયજા બની જાય છે તેમાં લર્દો છે ગુણાવ કહેતાં ગુણ્યાર્થ, તે મેં તને અહીં જ સમજાવી દીધો.

વળી હે કુન્તીપુત્ર ! કહેવાતા નિર્ણયવાદાભિમાની આખું રહસ્ય નથી સમજતા તેથી કર્મ સમર્પણ વિધિને તેઓ નથી માનતા. તેઓ તો બની એડા છે આત્મજ્ઞાની, તો પણ તેઓ ઈશ્વરને કર્મ કેમ સમર્પે ? વળી અહીં મેં તને ‘અધ્યાત્મચેતસા’ અર્થાત્ પ્રક્ષણજ્ઞાન યોગ્ય ચિત્ત ધારણ કરવા કહ્યું; તેનો અર્થ તેઓ સાધારણ અને વિના મહત્ત્વવાળો કરે છે. બારમા અધ્યાયમાં પણ હું તને હે અજ્ઞાન ! કહીશ કે, આવા અજ્ઞાનીઓ મારા ચરણમાં કર્મ અપે ? છે; ત્યારે તેઓ દઢ નિશ્ચય ધારે છે હે, હું, શ્રીકૃષ્ણ સર્વેશી માટે છું-હે અજ્ઞાન ! તેવો શ્રીકૃષ્ણ તેઓ ગમે તેને સ્થાપે પરંતુ તેમાં તેવા ગમે તેને જે તે સર્વોત્કૃષ્ણ પુરુષોત્તમ છે એવો ઠરાવે તો પણ તેને યોગ-પ્રાપ્તિ થઈ જાય.

અજ્ઞાન ! તને હું અનેક વાર કહી ગયો કે, આ શ્રીકૃષ્ણ ! એ જગતની દૃષ્ટિએ દેવકીની કૂઝે પાડેલો અને વસુદેવનો પુત્ર જીવે મનાય, છતાં જેમ સાધારણ મનુષ્ય, પિતાના શુદ્ધ અને માતાનાં શોણિતના સંચોગથી ઉત્પન્ન થયેલું પંચમહાભૂતનું પુતળું છે, તેવો હું નથી. તે શ્રીકૃષ્ણ સંગુણ અને સાકાર જીવે દેખાતો હોય, છતાં તે આકાર અને તે કૃષ્ણમૂર્તિ તો તે અચિન્ત્ય, અનિર્વચ-

નીય, નામ રૂપ પર, ધર્મનિદ્રિય પર, નિત્ય, અવયય, નિર્વિ-
કાર, અનાહિ, અજ, અવિનાશી એવી એક વ્યક્તિ, જેને
કોઈ પ્રવાસ, કોઈ પરમેશ્વર, કોઈ મહત્વ પરમાણું, તો કોઈ
એક અહીંડ, અચિન્ત્ય શક્તિ ઠરાવે છે, તેનું પ્રતિબિંબ
માત્ર છે. એવું સમજનારો હોય તે જ આ શ્રીકૃષ્ણમાં,
તે સર્વ સંપૂર્ણ અને પૂર્ણ કામ, અકર્તા, સ્વપ્રકાશ અને
સર્વ શક્તિમાન એવા તે અનાભીને નિરખે છે.

અજુંન ! નહીં, તળાવાહિ જગાશય ઉપર અનેક
મનુષ્યો, તે જગમાં પોતાની જ આકૃતિ નિરખી પોતા-
નેજ જુવે છે, છતાં તે પોતે નથી, તોપણ તેને તે પોતે
જ છે એવું માની તે સર્વે મનમાં ભલકાય છે તો ખરા,
છતાં તે પ્રતિકૃતિ ‘તે પોતે તો નથી જ’ કહેા કે તે
કાંઈ નથી, એવી રીતે જે આ શ્રીકૃષ્ણ મૂર્તિને જેશે
તોજ ખરા જાનીને તે મૂર્તિમાં અજનાની આંખી થશે અને
અજાનીને તો તે વાસુદેવ અર્થાત દેવકીનાં ગર્ભાશયમાં
પાડેલો અને દેવકીનાં શોણિત અને વસુદેવનાં વીર્યનાં
મિલનથી ઉમજ થયેલો સાધારણ શ્રીકૃષ્ણ જ નજરે પડશે.

આવા શ્રીકૃષ્ણને પોતાનાં સર્વે કર્મ ‘કૃષ્ણાર્પણ
કરનારનો હું’ અવશ્ય ઉદ્ધાર કરીશ. તેને હું સંસાર-
સાગરના વિહારસમયે અદ્ધર ઉચ્ચે રાખીને સંસારની સર્વ

લીલાનો અનુભવ કરાવીશ, છતાં તેને તે જળ (સંસારના કર્મબંધનથી) લિસ થવાં નહિ દઈ. તેને આવો સંસારસાગર વિહાર કરાવીને મૃત્યુ સમુદ્રને પેલેપાર-સામે-પાર-પહેંચાડીશ અને પેલા કહેવાતા અને આડંબરી નિર્ણયાપાસકના જેવો માત્ર નહિ, પરંતુ તેથી અફ્કો અને અનેરો આનંદ અનુભવાવીશ.

કૃષ્ણાપેણુ-મહિમા-નિર્ણયાપાસક, ભક્તે પોતાને જ્ઞાની માને અને પોતાના કર્મમાત્ર શ્રીકૃષ્ણને સમર્પનાર ભક્તે તેની દિલ્લિએ અજ્ઞાની મનાય, છતાં તે અજ્ઞાની (શ્રીકૃષ્ણને કર્મ સમર્પનાર) તે અજ્ઞાની કરતાં મોટો છે. તેનું મહત્ત્વ તે નિર્ણયાપાસક કરતાં અતિગાણું મોટું છે. આવા આ સત્ય વચ્ચને વિરોધ કોણું કરશો. સર્વત્ર એવું જ માની લેવાયું છે કે સર્વથી ચઠીઆતો જ્ઞાની છે લારે આ શ્રીકૃષ્ણ ગીતાના ખારમા અધ્યાયમાં આવાં પોતાનાં સર્વે કર્મો સમર્પનાર જ્ઞાનીને નિજ સુખે ચૌથી મોટો શા માટે કહેતા હુશો ?

આ રીતે નિર્ણયાપાસક જ્ઞાનીની કુદુક્તિ અનેક પ્રકારની હોય છે, તેમાં નવાઈ શી ! એ તો સ્વવચ્ચનની સ્થાપના માત્ર તેણે કરી હીધી. એવી તેની કહેપના તેવા જ જ્ઞાનીની દિલ્લિએ ગમે તેવી મોટી ઠરે છતાં તે રહે-

વાની અસિદ્ધ. તેમની, તે અનેક માંહેલી એકાદ કુયુક્તિ વાઈએ. એમનું કહેવું એવું છે કે આત્મજ્ઞાનીને પ્રભુ-કંઈતાની આવશ્યકતા નથી. એ ઉકિત, પહેલી દૃષ્ટિએ ગમે તેવી રૂડી અને લલચામણી હેખાય છતાં તે સર્વજ્ઞ શ્રીકૃષ્ણને સ્વીકાર્ય નથી એવું તે શ્રીરંગ બારમા અધ્યાયમાં કહેશે. વળી લાં જ આ સુકુંદ સમજનવશે કે, આવી આ આત્મજ્ઞાલિમાન કહાણી દીર્ઘદૃષ્ટિવાળી છે, એવું તે કહેવાતા જાની લલે કદ્યા કરે, પરંતુ ઉડાણુમાં ઉત્તરીને જોતાં એ તો છે. “અહીર્દા દૃષ્ટિ” લક્ષિત તો સર્વત્ર અને સર્વહા સુરસામૃત જ છે. એ લક્ષિતમાં અમૃતથી પણ અદકો સુરસ ભર્યો પહ્યો છે. ત્યારે આવા આ લક્ષિતભાવ પૂર્ણ તે શ્રીકૃષ્ણાર્પણ કર્મ સર્મર્પણનો પંથ આપણે સર્વથા સ્વીકારવો કલ્યાણકારક છે.

જાનપ્રાસિ લલે થાય, છતાં તે જાન પાકું થયા વિના દીર્ઘકાળ નભતું નથી. સગુણ-લજન વિના પાકું થનાર નથી તેથી જ્યાં સુધી તેવી સુદઢતા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી તો સગુણ અને સાકારનાં લજન કરવાં જ રહ્યાં. તદ્યથે જ શ્રીકૃષ્ણ અર્જુનને કહી દીધું કે “અધ્યાત્મ ચિત્તથી કર્મો કર અને તે કર્મો મને અર્પણ કરી હો, એવી રીતે જે તું ખુદ્ધ કરીશ તો જ તારો.

સ્વર્ધમ્ સચ્ચવાશે. શાસ્ત્રાનુભંગ પણ તેમ જ કહે છે કે,
 “જે આસને બેડા તે જ આસને જ્ઞાન પ્રાપ્તિ થશે.” ચુદ્ધ કરવાં એ તાર્દ ઠર્યું છે આસન. તો ચુદ્ધ કરવાથી
 જ તને જ્ઞાનસિદ્ધિ થશે—તારા માટે જ્ઞાનપ્રાપ્તિ સાધન
 આ ચુદ્ધ જ છે. તે ચુદ્ધ એક કર્મ ઠર્યું છે. ત્યારે તેવાં
 કર્મ તું કર. ચુદ્ધથી મનુષ્યને દેશાધિપત્ય પ્રાપ્ત થાય છે.
 તે હજી તને મળ્યું નથી. છતાં ચુદ્ધ કરવાથી તને તે
 મળશે જ. આ રીતે મનુષ્યને જ્ઞાનપ્રાપ્તિ લલે ન થઈ
 હોય છતાં, તેઓ અજ્ઞાની સુદ્ધાં જો સર્વ કર્મના સમ-
 ર્પણ તે શ્રીકૃષ્ણને કરે તો તે જન્મમૃત્યુની પરંપરામાંથી
 છૂટી પોતાનો મનખાદેહ સક્રણ કરે છે.



ઉ પ સં હા ર

કર્મયોગ કે જેનું મંચન શ્રીકૃષ્ણ પરમાત્મા જૈવાએ શ્રીમહુદી અગવદ ગીતામાં કર્મ પછી તેના ઉપર લે ડાઢ પણ મનુષ્ય વહું અજવાળું પાડવા જાય તો તે સર્વદીપિક પાસે પોતાના તેજથી ધંકવાનો પ્રયત્ન કરતા આગીયા કીડા જેવો જ હરે.

પ્રત્યેક જીબોએ આ કર્મયોગને સંસારીઓને ભાટે ઉત્તમ સાધન ગણ્યાયું છે. વળા આધુનિક કાળમાં સુધારાની ટાચે પહેંચેલા અને વિજ્ઞાનના શિરોમણી ગણ્યાતા અમેરિકામાં જરૂર તેદેખના પાશ્ચાત્ય વિજ્ઞાનીઓને જે યોગ શીખયો તેનું નામ રાજ્યોગ હયું છે.

આ લધુ ઉલ્લેખમાં પણ તેનો તે જ યોગ ચર્ચાયો છે પરંતુ તેને આપણે કર્મયોગ અભિધાન આપ્યું છે. વાચકે તેને પોતાની રૂચી અનુસાર ધટાડી તેવું વર્તન કરવું.

બ્રહ્મક્રિયાદ્વારા

॥ ॐ नमो भगवते वासुदेवाय ॥

આર્ય સંસ્કૃતિનું
પ્રાચીન એક્ષ - રે - એપેરેટસ
અથવા
વિજ્ઞાનના એ ભિત્તિ રૂપ



લેખક
મૂલા રણુછોડ વેદ

પ્રસ્તાવ ના

શખદ એક અને તેના અર્થ અનેક થાય છે. એ વાત સર્વ વિહિત છે. તેમાં વિજ્ઞાન એક એવો શખદ છે કે જેમાં અર્થમાં વિશેષતા પણ આવે છે. અને તે વિશેષતા એટલે વિભિન્નતા હ્યો; આપણે તે વિચિત્રતા જોઈએ. તે વિજ્ઞાનનો ઉપસર્ગ વિ. એક પ્રસંગે વિશ્વિષ્ટ ઇપ ધારણું કરે છે ત્યારે તેનો અર્થ પારમાર્થિક કે આધ્યાત્મિક જ્ઞાન થાય છે. હવે તેનો તે ૧૨ વિ. જ્યારે પલટો ખાઈ વિપરીત ઇપ ધારણું કરે છે ત્યારે તે તેવા વાચ્યાર્થ કરતાં ઉલટું ભાન કરાવે છે અને તે વિજ્ઞાનનો તે સમયનો અર્થ ખર્દું જ્ઞાન નહીં પરંતુ ઉલટું કે આડે રસ્તે દોરવવાનું થાય છે.

આપણા પ્રસ્તુત લેખનું શીર્ષક છે એક્સ-રે-એપેરેટ્સ. હવે પૂર્વ અને પશ્ચિમ, ઉગમણું અને આથમણું શું સૂચવે છે? ઉગ-મણુમાં સૂર્યનો ઉદ્ઘાટને એટલે પ્રકાશનો સંભવ. પશ્ચિમ એટલે સૂર્યસંત દિશા. વસ્તુસ્થિતિ આવી હોઈ, આ વિજ્ઞાન આર્યસંરકૃતિ અર્થાત ઓરીએન્ટલ oriental સંસ્કારિતામાં મનુષ્યને ઉજતિ-માર્ગ બતાવે છે. હવે આ ઉજતિ પણ વિજ્ઞાનની સાથે જ્યારે પશ્ચિમ દિશામાં પ્રવેશ કરે છે ત્યારે અર્થાત occidental civilisation કે પાક્ષાત્ય સંરકૃતિમાં પલટો ખાઈ જય છે. પહેલામાં પરાના મૂચન થાય છે ત્યારે તે બંનેના પલટો આ પશ્ચિમમાં

આપરામાં થઈ જય છે. પહેલો જ્યારે આત્મદિશાની સ્કુરણ્યા કરે છે ત્યારે ખીને જડવાદમાં પ્રગતિ કરાવે છે. આર્યસંસ્કૃતિએ વિજ્ઞાનને વિશિષ્ટ શાનદારે સર્વત્ર નહિ તોપણું અધિકાંશે વિશિષ્ટ શાનમાં વાપર્યું છે. ત્યારે પાશ્ચાત્ય વિજ્ઞાનીઓ—અહીં આપણે તેને ભાગ હાની નહીં પરંતુ વિજ્ઞાની એટલા જ માટે કહેશું કે તેનું શાન શુદ્ધ નહિ પરંતુ કંઈક વિશેષ અર્થાત આર્યસંસ્કૃતિ કરતાં લિખ કે વિપરીત છે—તે વિજ્ઞાન ઐહિક પ્રગતિ કે ધનસંપત્તિનો જેથી વધારો થાય તે પ્રાપ્ત કરવાના સાધન, યુક્તિ કે શોધ કરવાના અર્થમાં વાપરે છે તેથી જ આ લક્ષ્યમી, ધન કે સંપત્તિ પારમાર્થિક નહીં પરંતુ ઐહિક અને નાશવંત હોવાથી જડસંગ્રહ યામે છે, તદર્થે આ વિજ્ઞાનીઓ જડવાદી ઉપાધી પ્રાપ્ત મનાયા છે.

કેટલાકની માન્યતા તો એવી છે કે આ શોધ પાશ્ચાત્ય પંડિતોએ થોડા વર્ષો પહેલાં કરી જનતા ઉપર મોટો ઉપકાર કર્યો છે. આ ઉક્તિની કથન અમે માન્ય રાખશું. છતાં કહેશું કે આવું એકસ-રે-એપેરેટસ તેના આધુનિક સ્વરૂપમાં અને આધુનિક સંશાધારી ઇપમાં આર્ય ઇથીમુનિઓને લદે શાન ન હોય પરંતુ તેના રહસ્યવાળું એકસ-રે-એપેરેટસ તેમને શાન હતું અને તે દ્વારા તેઓએ અતિ ઉત્કૃષ્ટ અનેરો લાભ પ્રાપ્ત કરી મનુષ્યજન્મતું ધેય સાધી લીધું છે. અને તે ધેય એટલે જન્મમરણની પરંપરાથી છુટી જવું.

ગ્રીન બંગલો અંધેરી.

મુળાલ રણછોડ વેદ.



આર્ય સંસ્કૃતિ સૂચન પ્રાચીન એક્ષે-રે-એપેરેટ્સ



એકાંકી નાટક



પ્રવેશ પહેલો.

દાહુલા દરખારઃ અહ્યા માનસીંહ ! કલકત્તાથી
અણીલાઈ શોઠ આવ્યા છે તો એને ઉતારે જર્ઝ ખખર
કાઢી આવ તો ખરો કે તેને કંઈ જોઈએ કારવે છે ?

માનસીંહ : બાપુ ! આ એલદ હુમણું જ ત્યાં થઈ
આંયો. ણધી તજવીજ થઈ ગઈ છે. પરંતુ જ્યારે હુધની
તાંસળી તેને આપી ત્યારે તેનો પુત્ર પ્રેમચંદ કહે, મને
તો સા જોઈએ ! તે બાપુ ! સાનો ડાયો આંયો નથી
ઇનું કેમ ?

એલલાઃ માળું ! આવી ખબરું હોત તો ભાવન-ગરથી કે જેતલસરથી ઓલ્યા ધનજી સાથે મગાવી ન દેતા !

દાહુલા દરખારઃ જુઓને, આપણા લાલભાઈ શેડનો દીકરેા અહીં પરીક્ષા પહેલા પોતાનું પાકું ભણુતર કરવા આંદ્યો છે તેને ત્યાંથી ઓણેા એક માળી આવેા. અને હમણું તો કામ રોડવેા.

એલલાઃ બાપુ ! પણ આ સાનો સ્વાદ તે કેવો હશે કે માળાં જે તે શહેરી કે થાડું ધણું અષ્ટંપદ્ધં ભણેલા અહીં આવે છે ત્યારે તેને આ ઉકાળા વના ચાલતું જ નથી.

માનસીંગઃ એલા એલલા ! એક ફેરી એ સાની ટેવ તને પડેને ત્યારે જ તને ખબરું પડે કે આ સા કેવોક હોય !

દરખારઃ પણ એ માનસીંહ, પણ આ માળો માન-સુર ગઠવી તો જયારે ત્યારે વાડું જોવરાવીને અને આંખું ઘેંચાવીને કાયર કાયર કરે છે. માળાને કાલેજ કઢ રાખેલ હતું કે આપણે ત્યાં કલકત્તાના મેમાન છે તો તેનું મન રીજવવા અને તેના એમચંદ છોકરાને મોઝું કરવવા વહેલો આવજે. છતાં હળ્ય તે કેમ ન ગુડાણો ?

એલલાઃ “ પણ બાપુ ! એને જરા ડીકું દીધાં હોય જો એની ઝુદ્દી ડેકાણું આવે ખરી હો !

માનસીંગઃ એ માળા મૂરખ ! આવું કાચું દાયરે શેળો થયો હોય ત્યારે કાપીશમાં હો ! નહીં તો એ ગઠવી, ને એ ચારણુ, ને ઓલ્યા બારોટ તે હેવી પુતર ગણ્ણાય. ભુંડા ! તે એકાદ શરાય કઈ હેશોને તો વનવન રખડતો થઈશ.

બાવો હજુરીઃ બાપુ ! ઓલ્યા શેડ ને તેનો કુમાર હાલ્યા આવે છે.

દરખારઃ એલલા, જ હોડતો ! એ માણુસુરીઓને બાં પકડી આંધ લઈ આવ, લઈ આવ. નહીં તો આપણો ફૂજેતો થશો. જો, હોડતો જઈ, જઈ આવ.

એલલાઃ ધણી ખમા, બાપુને. આ આ આ એને લઈ આંદોલ.

પ્રવેશ બીજો.

એટો જોડા ખખજ્યા. ડાંડરે કોઈકના પગલાં સંભળાણું એટલે ૩-૪ ખવાસ અને હજુરીઓ તેમ જ અમલના આશ્રીત જે ઢાંકા દરખારના ડાયરામાં આવ્યા હતા, તે ઉલા થઈ ગયા. માત્ર દરખાર ઢાંકા તથા તેના એ કુંવર એસી રહ્યા.

એવામાં મણીલાધ અને તેનો પુત્ર પ્રેમચંદ અનૈ

કારકુન કાળીદાસ આંયા એટલે પહેલા એ કુંવર અને
પણી દરખાર ઉલા થયા. શિષ્ટાચાર પ્રમાણે સત્કાર યયા
અને દરખારની ડાણી બાળુએ તે વ્રણેને સ્થાન મળ્યાં.

મણિભાઈઃ દરખાર ! કલકત્તામાં તમારા માણુસુરની
ખ્યાતિ તો બહુ બહુ સાંભળી છે. વળી તેણે કાંકડીના
કષ્ટથી તે પોતાની ક્રીતિ ચોગરદમ ફેલાવી હીધી છે.
એ બધા ચારણુ કે ગઢવી એટલે રાજવીના જેવાં જ
સુવિખ્યાત છે. જ્યારે લગવાને રાનમહારાન, દરખાર કે
ઠાકેરને રાજયદંડ અને લક્ષ્મીથી પ્રસન્ન કર્યાં છે લારે
આ દેવીપુત્રોની લુલે સરસ્વતિની સ્થાપના કરી, રાજ-
વીના જેવી જ પદવી અર્પણ કરી છે, કોઈ કોઈ પ્રસંગે
તો આ ગઢવી રાજવી કરતાં પણ ચઢી જાય, જ્યારે
રાન પોતાનો ધર્મ ચુકે કે રૈયતની કોઈ રાવકરીયાદ
તે પવન જેવા ચંચળ મનવાળા દરખાર કે રાનને કાને
ચાંટીઓ ભરી, તે રાવ સંભળાવવી હોય અથવા તેની
શુદ્ધ ડેકાણે લાવવી હોય ત્યારે પ્રધાન, પુરોહીત કે પોથા
ઉથલાવનારા હીસાણી અધીકારી હાર ખાઈ જાય છે તેવે
કટાકટીના પ્રસંગે આ ગઢવી જ તે રાજવીના કાન
ચેંચી શુદ્ધ ડેકાણે આણે છે. તે માંહેલો આ માણુસુર
ચારણુ છે. આટલી નાની સરખી કાંકડીને તેણે લડાવી

લડાવી છેવટે કેવી ચડાવી, તે *કંકરીના કષમાં સુધદ અને કુવડ નારનાં રૂપ આળેજ્યાં. શાહ અને સાહુકારનાં સામ્ય ચીતર્થીં અને વળી નાનાં કે મોટાં, સ્થી અને પુરુષ તે બધાના ત્રણુ આવશ્યક સાથીના વર્ણન કે શુણુગાનુ ગાઈ આ માણુસુરે જનતા ઉપર મોટો ઉપકાર કર્યો છે.

દરખારઃ મણીભાઇ શેઠ । ગઠવી કે બારોટ એ તો રાજવી માત્રના સાથી જ ગણુાય. આવા બારોટ વિનાના દરખાર સુના જ હોય. દાયરો પણ ચારણુ વિના જાંખો જ લાગે. વળી અમે જે ડાહીના ગાંડા ગણુાઇએ છીએ તેનું ગાંડપણુ ખંખેરી ફૂરી પાછા ડાહ્યા બનાવનાર આ ગઠવી કે બારોટ છે એ સાચી વાતનો અમે સ્વીકાર કરીએ છીએ. એ કાન પકડવાનો અને કાન મરડવાનો અધીકાર અમોએ તેને તેના મૂળ જોઈ આખ્યો છે. કારણુ કે અડીકડીને વખતે રાજ્યના હિતાર્થે કે રાજ અને તેના કુટુંબને ઉજ્જ્વલિ અને રક્ષણુાર્થે માથાં પણ આ વણીક પ્રધાન કે કારસારી જ્યારે નથી આપતા ત્યારે આ હેવી

* આ લેખ શારદાના મે માસના અંકમાં આવી ગયો છે અને તેની આઉટપ્રીંટ ડાપી જેને જોઈએ તેને ત્રણુ પૈસાની ટીકીટ ભીડી લેખક પાસેથી મંગાવી લેની.

મુત્ર પોતાને હાથે વિકસિત કુસુમના જેવું માણું વાદીને
આપતાં વિલંબ કરતા નથી. વળી તમે તો સુજ હાઇ
બાણુતા હશો કે અમે રાજવીએ. તેના માન પણ એવાં
જ જગવીએ છીએ.

એવામાં તો માણુસુર ગજયો: “ ભલે, બાપુને
ભલે, ધારી ખમા મારા અજદાતાને । સુરજ નારાયણ,
તેની કાયા અમર કરો અને બાપુના રાજ કાયમ તપો। ”
આવા અવાજ કરતો ભરેલી છાતીવાળો, શુદ્ધ સફેદ કપ-
ડામાં સજજ થયેલો ગઠવી આવ્યો. તેણે પહેરેલો હતો
ચારણ્ણો, લેટ બાંધી હતી. માથે આટી પાડેલો ઝેંટો
અને કાખમાં હતો ઐસ, એવો આ માણુસુર, દરખારના
પગલાં ફુર્વેશ બનલવી ઉલ્લો રદ્ધો.

દરખાર: “ ગઠવી ! આવો, આવો. ” કહેતાંક
માણુસુર એઠો.

વાહ રે, હુલ્લા શેડ મણિલાઇ ! તમે તો કલકતા
જેવો પાધર પ્રહેશ પોતાનો જ કરી લીધો. હવે તો
વેપારના રાજ્ય ચાલે છે. એ રાજ્ય તમે કલકતા જેવી
શોમીમાં જમાવી દીધાં અને અનેકનાં પાલનહાર કરણું
બની એઠા છે.

હે, આ નાના શેડ પણ આવ્યા છેને !

દરભારઃ ગઠવી, આજ તો અસુરા કર્યાં હોએ ! કું
તો ટીક થયું કે એલલે યાહ આપી અને એલલે તમને
હાજર કર્યાં ગઠવી ! જરા વહેલા આવ્યા હતને તો આ
મણિલાઈના વેણુ સાંભળી તમને તો એવું થઈ આવત
કે બારોટની પદવીને લાયક તો તે શેડજ છે.

માણુસુર, “ ખમા, મારા અજદાતાને ! ત્યારે કો
તો ખરા, એવો તે કયો સુલાગી નર હતો કે જે આ
કરણુંની પ્રત્યક્ષ પ્રતિમા રૂપ મણિલાઈ શેડને મુખે બીરદ
રૂપી કુસુમનો વધાવો પામ્યો.

દરભારઃ ત્યારે ગઠવી ! એ અનુમાન તમે કરો
નોઈએ. એવો કયો ભાગ્યશાળી નર હશે કે જે શેડની
અલે વખણુંણો !

માણુસુર: બાપુ ! એમાં કંઈ પુછવાખણું રેતું નથી.
એ તો આપ જેવા શાહના આ શાહુકાર ભાઈબંધ બંને
લાંબે કાળે લેગા મજયા ત્યારે આપની મોઝું આપને જ
મણુંવે ? બાપુ, કેમ સાચું કયુંને ?

દરભારઃ ગઠવી ! તમારાં અનુમાન ગોટાં હર્યાં
માળો ગઠવી છેને પાકો તો હોએ ! એ માણુસુર ! તું પણ
હવે રાણ પેઠે પંકાણો હોએ ! અરે ગાંડા ! તારી કીર.
તીયું તો ઠેડ જર્તી કલકતા રહોંચી કલકતા ! અને

આ મણીભાઈ શેઠ, તારી ચેતી કાંકરીના કષણીજ કથા કરતા હતા.

પ્રેમચંદ: કુમાર અલયસીંહ ! આજ આપના કવિ કે ? જરા ગઢવીને ફરમાશ કરો તો કંઈક અમે તેની વાણી કેવી મીઠી છે તે તો સાંભળીએ !

કુમારે પોતાના પિતાના મુખ સામું જોયું એટલે-
દરખારઃ ગઢવી ! આ નાના શેઠને તમારી કાંકરીના કષણી ગલોલી લાગી ગઈ છે. તે આવ્યા ત્યારથી તમને જોવા ને તમારી ચારણી વાણી અને પરાકરણી વાતો સાંભળવા ઉલ્લે પગે થઈ રહ્યા છે.

માણુસુરઃ ધણી ખમા મારા નાનકડા પ્રેમચંદ શેઠને ! પ્રેમચંદ શેઠ ! ત્યારે કહો જોઈએ, આપની મોઝુંમા આવે તેવી વાતો કરું.

પ્રેમચંદ: કવિરાજ ! એ તમારા રાજ અને પાદશાહ, લડાઈ અને સંધિની વાતો રોજ કરો છો પરંતુ આજકાલની શોધમાં કાંઈ તમારી ચાંચ બુડે ખરી ?

માણુસુરઃ પ્રેમચંદ શેઠ ! કહો તો ખર ! કે આ રવિના કણું ક્યાં નથી રહ્યાંચતા ? આપ તો જાણુતા જ રૂશો કે આ બાપલા સુરજનારાયણના કણું ખંધે રહ્યાંચ્યે

છે તો માત્ર તે જ્યાં ખેંચતા હોય ત્યાં તો ઢીક !
 છતાં તેથી પણ આત હુર સુધી અમારી ગઠવીની દસ્તિ
 પ્રવેશ કરે છે. તેથી જ કહેવાણું છે કે જ્યાં ન ખેંચે
 રવિ ત્યાં ખેંચે કવિ.

પ્રેમચંદઃ એ તો બધું ગઠવી ! જુનું થયું. આ
 પ્રગતિના જમાનામાં અને અમારી જેવા પાસે ચાવેલું
 અને ચુંથાયલું ન ચાલે હો !

માણુસુરઃ ત્યારે પ્રેમચંદ શોઠ ! તો હું બીડું
 અડપું છું કે આપ જે વિષય કહો તે વિષયમાં મોઝ
 કરાવી આ અદ્ય શક્તિવાળો માણુસુર આપની અને
 આપના પિતા કરણું જેવા ભણિલાઈ શેડની વાહુવાહુ
 મેળવી શીરપાવમાં મોળીયું લેશો.

પ્રેમચંદઃ એવા મોઢાના લવકારાથી અમારી જેવા
 ન સંતોષાય હો. એ તો કહો છો તેવું કરી બતાવો
 ત્યારેજ અમે આધુનીક જમાનાના છોકરાઓ રાણુ થઈએ.

ભણુચંદ શોઠઃ પ્રેમચંદલાઈ ગઠવી તરફ આવા
 શબ્દો ન હોય. વળી કનિની શક્તિને તમો આજકાલના
 જીવાનીઆ આંકી ન શકો. તેમાં પણ આ માણુસુર
 ગઠવી જેવી કૃતિ કાંકરીના કષ્ટથી તો તમે અને તમારા
 મિત્રો સુગધ બન્યા હતા. વળી તેને સુખે તમારા તે

એક્સ-રે-એપેરેટ્સનાં ગુણગાન સાંભળવાની તમારી અધાને છંદ્ધા થઈ હતી, તો એવી સીધી વાત કરવાનું બાબુએ રાખી આવે આડેટેડ માગે ના જઈએ.

પ્રેમયંદઃ ક્ષમા કરને કવિરાજ ! એ તો અમારે ખાળેનો ટીંખળી સ્વભાવ જ અમારે મુખે આવું હાસ્ય કરાવે છે. ખરી વાત તો એ છે કે આજકાલ ચૌષધને અને દ્વારાને નમાવતું અને મહાત કરતું ચેલું એક્સ-રે-એપેરેટ્સ નીકળ્યું છે તેનાં ગુણગાન માણુસુર કવિ ગાય તો કેવો આનંદ મળે ! તે સાંભળવાની અમારા ગોઠીઆની છંદ્ધા થઈ. બાકી હું કયાં નથી જાણુતો કે કવિની વાણીની મીઠાશને કોઈ ન ઘેંચે ? વળી તે કવિ શહેનશાહના જનાનાની વાતો અને ગરાશીના ગઢના રહસ્યોના વર્ણન કરે તેની શક્તિ અનેરી જ હોય. પરંતુ ગઢવી ! આ એક્સ-રે-એપેરેટ્સ શું છે ? તે કાર્ય શું કરે છે ? કોકોના ફુંખ અને કરદ મટાડવામાં કેવું અનુપમ સાધન છે એ બધી વાત હું તમને ઘેલાં સમજલવી હઉ અને પણી તમે તે કવિતામાં ઉતારો તો ભારે હીપી નીકળો.

માણુસુરઃ પ્રેમયંદ શેડ ! એ વિતા આપ નહીં કરતા. જે એક્સ-રે-એપેરેટ્સની આપે હમણું વાત કરી

તે મેં જોયાં છે; તેને પ્રવૃત્ત સ્થિતિમાં પણ જોયાં છે. જુઓને પ્રેમચંદ શોઠ! અહીં આપણું કંઈ અને શુજ-રાતમાં એ વાતની નવીનતા છે ત્યારે ભૌસુરના રામરા-જ્યમાં તો એ વીજળીક ઉપચાર કે એકસ-રે-એપેરેટ્સ તેમજ સાથેસાથે આ ટેંચણું જેને તમ જેવા ઈન્જેક્શન કરું છે એ તો ચાસુંડ રાજની રાજધાનીમાં અને ચાસુંડી હેવીના સાઓન્યમાં જમાના જુની વાતો થઈ—

દરખારઃ ગઠવી, કં આડા ક્ષાણ્યા ને ? આવી વાતો કરી અમ જેવાની અને સાથે સાથે આ મલક દેશ કે પ્રાંતની નિંદા કરવી મુકી ધો.

મણુભાઈઃ અને પ્રેમચંદ ! તું પણ તારી દ્રાવીડી આણ્યાયમની વિધિનો ત્યાગ કરીને, તે માણુસુર કવિના જે કવિત સાંલળવાની ઈચ્છા હોય તે પાધરા જણ્ણાવી હે કે માણુસુરની વાણી સાંલળીએ.

પ્રવેશ ઉ જે

દરખારઃ ગઠવી, આ નાના શેડનું એકસ-રે-એપે-રેટ્સ તો માણું નવીન હો. તેનું કવિત પણ તેવું જ થશે. ત્યારે એ સુંદર વર્ણન આપણે સાંજ ઉપર રાખીએ તો મેળ પણ મળશે, અને કંઈક તમે તૈયાર થઈને આવી શકશો અને ત્યારે જ રંગડા જામશે.

મણિલાઇ શેડઃ દરખાર સાહેબ ? આજકાવની
પ્રભાને પ્રભુ જેવું કંઈ હેખાતું જ નથી. તો પછી પ્રભુની
કૃતિમાંથી આનંદ લેવાની વૃત્તિ તે કયાંથી જ હોય ?

પ્રેમચંદ : પિતાજ ! તે ચુવક જનતાની વતી આપનો
આ આહેય હું નહીં સ્વીકાર્દિં. જેને ખરી આંખો છે,
સાચાં કાન છે, પ્રભુદ્વત્ત હૃદય છે તે તે સર્વત્ર પ્રભુની
અંખી કરે છે. પ્રભુની કૃતિમાં પ્રભુને ઓળખે છે અને
હૃદયના ઉંડાણુમાંથી ઉદ્ભવતી રકુરણામાં પ્રભુનો અવાજ
સાંલળી પ્રભુ સાથે વાતો કરે છે. ગઠવી ! ક્ષમા કરજો
હેં. પરંતુ હું કહીશ કે આ કવિ અને થડીબંધ ગાનારા
ગવૈયા કવિના કવિત્વ તે હૈવી ગવૈયા પાસે તેના અનુચ્ચર
જેવા બની જાય છે. થાડી ધણી આડની ધટા હોય, કે
નાનો સરખો જેને બગીચો હોય, પ્રાતઃકાળ થયો હોય
તેવે સમયે આ ઐહિક ખદખદતા વાતાવરણમાંથી લક્ષ્ય
ચેંચી કાનને સરવા રાખ્યા હોય તો ખુલખુલના મહુરાં
અને કર્ણુપ્રીય ગાનથી મનને મળતો આનંદ મનુષ્યમાત્ર
પામી શકે છે.

અલયસીંહ : મિત્ર પ્રેમચંદ ! માસ્તર, મહેતાજ ! કે
શુરૂ તો ઐહિક શિક્ષણ જ આપે. તેના શિક્ષણ એટલે
આ પીડ પોષવાના સાધનોની પ્રાસિ કરવાની શક્તિ

વધારવી. પિતાજી ! તે સુખમય અને પુણ્યહા સમય ગયો કે જેમ શ્રીકૃષ્ણ પરમાત્માને સાંદિપની રૂપિ, શ્રી રામચંદ્રજીને વશિષ્ઠ મુની અને લવકુશને વાલિમંકી જેવા સફુરુ હતા. સાધારણ જનતાને મેલા અને ઘેતા લાગતા પંતુજી પણ આવું જ હિતકારક શિક્ષણ આપતા હતા. તેવા શિક્ષણમાં નહેતા તેવા મહેતાજીને પોતાના ચેટ માટે જ શિક્ષણ આપવાની કાળજી કે તેના શિક્ષણમાં માત્ર આજીવીકાની પ્રાસિ કરવાની દુંછા. તેવા શિક્ષણમાં તો પારમાર્થિક પ્રગતિ ઘેડી અને ત્યાર પછી જ વ્યવહારિક કૌશલ્યના પાડ પડાવવામાં આવતા. તે કાળ ગયો; છતાં આ મારા સનિમત્ર પ્રેમચંદ તથા આપની કૃપાથી મને મળેલા મહાશંકર મહેતાજી એ જ ઘરેડમાં કામ લીધે જય છે. તેથી જ પ્રબુમાં આસ્થા, વડીલ પ્રતિ વિનય અને જનતા તરફ સમલાવ અને પ્રેણુલાવના પાડ અમો ગોએ રાખીએ છીએ. વળી પ્રબુકૃપા પ્રાસ આ નૈસર્જિક લીલામાંથી અમને આનંદ લેવાનો મોકો ચુક્તા નથી હો. ભાડી આપણું દરભાર, રાજસલા અને સાથે સાથે આવા ડાયરા તો અમ જેવાને ગુમાની, ગર્વિત, ઝાંટાણાજ અને નિષ્કુર જ અનાવી મુકે. ગઢવી ! જેમ લાઈ પ્રેમચંદે ખુલખુલના હિંય ગાનનાં ગુણુ ગાયા, જેમ આપણું આ વગડામાં

તેવાં જ સાહુનકી, ફેવચકલી અને પપૈયા આહિ નિદોષ
પંખીડાંનાં ગાન સાંભળનારા પણ પહ્યા છે. પરેદીએ
શૌચ વિષે જંગલમાં જનારા આવાં ગાન સાંભળે છે,
સુદ્ધિસૌંદર્ય જેતા જથ છે અને પૃથ્વી માતાની રજમાંથી
પસરતી સુરલિથી મનને અને મગજને તૃસુ કરે છે
ત્યારે મૂઠ હોઈ તેના મનના વિચાર તો “ હસ્ત
આવશે કે નહિ, કાલ તો ઠાંસીને ખવાળું છે, માળું
જે આડો ઠીક નહીં થાય તો દિવસ બાગડશો ” ત્યારે
મણિયંદ શેડ ! તેનું પરિણામ તો તેવું જ આવે છે
અને આખો દિવસ ચેટનો હુઃખાવો અને તદ્જન્ય
માથાનું ઝરવું કે ચકરી આવવી ચાહુ રહે છે.

માણુસુરઃ ધાણી ખુમા ખાપુને ! ખાપુ ! આ તો
મેરાનાં ઈડાં ચીતરવાં કંઈ પડે ? જેવા આપ પ્રતાપી
છો તેવા જ કુમાર અલયસીહ નીવડ્યા હો ! અત્યાર
સુધી અમલ લેવા તો હું અનેક વાર આંદોલનો
કુમારનું પાણી તો આજે જ દિલ્લોચર થયું. ધાણું
જીવો મારા અજ્ઞાતાની અમર વેલડી ! જેવો દાહુલા
કરણુનો અવતાર, તેવા જ આ તેના આત્મજ કુમાર
અલયસીહ. વળી—

દરખારઃ ગઢવી ! આ પ્રકરણને પુરું કરેલ. જમ-

[૯૪]

વાની વેળું થઈ ગઈ છે. એલક્ષ્મિ! મેમાનને ઉતારે જઈ
ખખર આપ કે બધા જમવા આવે છે.

પ્રવેશ. ૪ થો.

આજે તો આ હાહુલા દરખારનું ગામ ઉલટચું છે.
કલકત્તાથી આવેલા શાહુ વેપારી મણ્ણીલાઈ અને તેના
પારસમણ્ણ જેવા પુત્ર પ્રેમચંદના માનમાં દરખારગઠમાં
દાયરે જમવાનો છે અને તે સકળ દાયરાને રીજવવા
અને મણ્ણીચંદ અને પ્રેમચંદને કવિતોની મોઝ ચખાડવા
માણુસુર જેવો મહારથી લેઠ બાંધીને તત્પર રહેવાના
છે. જે દાયરામાં સાધારણું રીતે અપ્રીણ્ણીયા કે અમલનાં
જ અધિકારી મળતા હતા તેનો પલટો આજે તો ડેવળ-
રામલાઈ, નરભદાશંકરલાઈ, સાકરચંદ શેઠ, કડવા
ઝેલા, મીઠાલાલ, વળી સાથોસાથ પાંચો પટેલ રૂડો
રોકડીએ, અને પોચો કુંભાર પણ આજે તો ઝેંટા,
પાઘડી અને નવધરાં બાંધી શરીરને શાણુગારી દરખાર-
ગઠ તરફ હંરીયું લેતા નજરે પડતા હતા.

દરખારગઠમાં પ્રવેશ કરતાં જ કનકસીંહ, ધોરા-
સીંહ, અને લાલલા બધાનો સત્કાર કરતા હતા, ત્યારે
શ્રીકમાં એલક્ષ્મિનો ઈસારો થતાં અભયસીંહ ને અણત-

સૌહ કુમારો પોતાના પીતાના પ્રતિનિધિ તરીકે હાણી અને જમણી બાળુથી આગંતુકોને માન આપતા હતા. અધ્યો કલાકમાં તો દરબારનો ચોક લરાઈ ગયો. દરબાર પધાયો અને ત્યાર પછી આજના મહેમાનોને તેડવા અભયસીંહ અને અણુતસીંહ પોતાના મિત્ર પ્રેમચંદ અને તેના શીરછત્ર મણિચંદ શેઠને તેડવા ગયા. જોત-જોતામાં બધા ઉલા થયા. અને ખેલાં દાહુલા દરબારે બેઠક લીધી, પછી બેઠા મણિલાઇ શેઠ અને પછી પ્રેમ-ચંદ અને કુમારો, અને ત્યાર પછી ગામના ગૃહસ્થો, મહાજન અને અન્ય જનો બેઠા. દરબારગઢનો જમણો ભાગ કૈંક જીવનસૂચન કરતો હતો. લીલોતરીનો પડહો જો કે નજરે પડતો હતો. પરંતુ તે પાન અને વેલના શાણુગારની પછવાડે તેમજ હરીયાળા રંગના સુશોભીત ચક તાણી દેવામાં આવ્યા હતા. તે ચકની વચ્ચે ચોરસ બારીઓમાંથી ગવાક્ષ તો હીરની દોરીની ગુંથણી અને વચ્ચમાં વચ્ચમાં ચળકતાં મોતી અને લાલ લીલા આદિ મણિ, સુંદર આકૃતિમાં ગુથેલાં હતાં. તેની ઓથે ગૃહ-સ્થાશ્રમના પ્રધાન અને ધરની શોલર્સપ તેમજ પકવાનમાં પાવરધી સ્વીઓ અર્થાત રાણીઓ અને રાણીવાસની કુંવરીઓ, બાંધીઓ અને સખીઓ બેઠાં હતાં. ત્યારે ગુરુષોની પછવાડે આહની ઓથે કે ખુલ્લા ચોકમાં નિર્દોષ

હરિણીએ અને નાનાં ભૃગલાં રૂપે હસ્તે મુખે કણુખણો અને સુમુખી અને સદાય હસતી કણુખીની બાળાએ આ અવનવું જોવા અને સાંભળવા લેગી થઈ હતી. જ્યારે રાણીવાસમાં કે શાહુકારના મહેત કે પ્રાસાદમાં હરિણુક્ષી શોધી મળતી નથી ત્યારે અહીં તો થાડા અપવાહ સિવાય બધી હરિણુક્ષીએ જ લેગી થઈ છે. હે વાંચક ! હવે કહે જોઇએ, નિર્દેખતા અને પ્રસન્નચિત્ત આ છેને અને પુત્રીએના દર્શનથી તને આનંદ નહિ મળે ? એ તો જે સુલાગી આ પરોપકારી કણુખીના કુટંબના પરિચિત હોય તને જ આવો અમોકો આનંદ પ્રાપ્ત થાય; અન્યને નહીં.

હવે બધાની દૃષ્ટિ એક જ સ્થળે એંચાણી. ઘણી અર્મા બાપુને ! લલે, મણિલાઈ શોઠને લલે ! મારા બાપુના રાજ અમર તપો ! ધન્ય છે આ શાહપુત્ર પ્રેમ-ચંદલાઈને અને સાથે સાથે આ અલયસીંહ અને અળત-સીંહની ત્રિપુરી શુક્લપક્ષના ચંદ્રની કળાની પેઠે વધતી જાએ. કેમ, પ્રેમચંદ રોઠ ! આ તમારી પ્રાચીન એકસ-રે-એપેરેટસની ફરમાશને પોંખશું ને ?

આવો પ્રસ્તાવ થતાં જ મણિલાઈએ દાહુલાના કાનમાં કેંક વાતો કરી અને પાછા પોતાને સ્થાને ગોઠવાણું.

દરખારઃ ગઠવી ! આપણું આ દરખારગઠમાં આવો
જમેલો. તો પહેલો જ થાય છે. કન્નિતદ્વારે બધાને રંજન
કરવા જતાં લાંબુ થઈ પડે. મારી સૂચના એ છે કે
આજના સમૂહને રંજન કરવા ગઠવી માણુસુર સૂત્રધાર
અને પ્રેમચંદ અલયસીંહ તેના સહાયક પાત્રો બને.
વળી કથન કરનાર એકલા ગઠવીજ નહીં પરંતુ સંવાહ
દ્વારે આ શાહુપુત્ર અને રાજુપુત્ર તેને સાથ આપે.

તેવામાં ચક પછ્ચાંદેથી અવાજ આવ્યો કે બાપુ !
તો સંવાહ દ્વારે જ આજનું કથન હોય તો મારું પણ
નામ તેમાં દાખલ કરનો.

મણિચંદ : બાપુ ! આ તો આપણી મેનાયેનનો
અવાજ લાગે છે.

એવામાં તો મેના હાજર થઈ. હે વાચક ! નીલ-
વણી વર્ષાદ્રિતુની ઘટામાં જેમ વીજળી ચમકે અને જણુકા
હે તેવો જ ધાર આ કુંવારી મેનાના આવવાથી ઘડાઈ
ગયાનો લાસ થયો. મેના આવી'તી હરિણી શી, અને
આવી ઉલ્લી રહી પણ તે જ પ્રમાણે હસ્તે સુઝે.

દરખારઃ મેનાખા ! ત્યારે તમે પણ એક પાત્ર
અનશો ખરાં !

મેનાઃ બાપુ ! મેનાનું તો નામ તે ઓલી લ્યારથી

બખાઈ ગયું પણ સાથે સાથે મારી સખી લાનુમતિનું
નામ પણ આ લીસ્ટમાં ઉમેરવું પડશે.

મહિયંદઃ એ લાનુમતિ કોણું ?

મેનાઃ કાકાળ ! શું આપ પેલા રણુમુક્ત ભાઈને
નથી ઓળખતા ? તેના એ પુત્રી થાય ? અને હું
એકલી આવું તો મને કંઈક —

ગઠવીઃ બા, એ કંઈક શું ?

મેનાઃ ગઠવી ! એ કંઈક એટલે તમ જેવા ગઠવી
ન સમજે ત્યારે આ બીચારાં લોળાં અને લલાં લોકને
તેની ગમ ક્યાંથી હોય ?

પ્રેમયંદઃ ગઠવી ! હો આ મેનાયેનને જવાબ ?
તમે તો કસોટીએ ચક્કા હો !

માણુસુરઃ આ મેનાખાઈએ તો ભારે કરી ! પોતાને
આવે શરમ અને માણુસુરે તેના સુખ જનવું. હ્યો આ
મેનાખાઈને એકલા આવતાં લાજ લાગે.

હવે તો સ્થિતિ એવી થઇ કે મોટો વરસાહ આવાંનાં
પહેલાં અથવા કોઈ અતિ મોટું રમખાળું થવાનું હોય
તે જેલાં જે શાંતિના વાતાવરણમાં જણાય છે તેવી
સ્થિતિ અને શાંતિ આ મનુષ્ય મેહનીની થઈ ગઈ. જ્યારે

વર्षांદ હેલांની શાંતિ અતિવૃદ્ધિના સૂચન હરે છે, મનુ-
ષ્યોના કોધયુક્ત ચહેરા અને ભીડેલા હોઠ છતાં સુખો-
ચ્યાર વગરના હલનચલનમાં લયંકર દગ્ગા કે હુલ્લડના
ચિનહુ દર્શાવે છે, વથી ઉલટું આ માનવમેહનીના જમે-
લાની શાંતિ તો માત્ર તેમની ઉત્સુક્તા વ્યક્ત કરે છે.

દરબારઃ ગઢવી ! હવે કરી ધો આદર !

માણુસુરઃ નાના શેઠ પ્રેમચંદલાઈ ! હવે આણ્ણો
તમારું એક્સ-રે-એપેરેટસ. આપના પિતાની સ્કુરણ્ણા
અને બાપુના સૂચન પ્રમાણે તેના ગીત કવિતમાં નહીં
પરંતુ સંવાદ રૂપે ગવાશે

પ્રવેશ પ મો.

હુ વાયક ! અત્યારે લોકોની આ એક્સ-રે-એપે-
રેટસરૂપી જનાવરને જોવાની ઉત્સુક્તા એટલી બધી છે
કે આ સમયે જો કોઈ સુંબધને ખીસાકાતરૂ ગીલેયીની
ધાર અજમાવે તો તેને અનેકના ખીસાં કાતરવાની સુગ-
મતા મળે. પણ તે ખીસાકાતરૂ બડા ચખરાક હોઈ
અમથા પટેલને જડદો કે કાના પટેલની ચુંગીના તે
ધરાક નથી, તેથી અહીં હાજર થયા નથી.

ભાનુમતિઃ બહેન મેનાબાઈ ! હવે આ એક્સ-રે-
એપેરેટસને આણ્ણો તો !

ભાનુમતિના સ્વીચ્છાન સાથે લોકોમાં ગણુગણુટ સર્વ
થયો.

એક લોળી હુહારણુ બોલતી સંભળાણી કે એવા
મગના ! જો જો હુમણું એદયું એકસરા જનાવર આવ-
વાનું છે. પછ્યો, મુંગો મરતો નથી.

ત્યાં કડવી પટલાણી “એદી રાધકી, મુંગી મર !
અભધકી અહીં એદયો, એકસરો એર આવશે.

આવી રીતે લિન્ન લિન્ન ઉદ્ઘાગ અને લિન્ન લિન્ન
ભાવનના વરસાહ વરસવા શરૂ થયા. ને કેમ જણે
બધાને ઉગતાંદાંભવાની તત્પરતા હોય તે પ્રમાણે પ્રેમ-
ચંદની જાહુઈ લાકડી ઉપડી.

પ્રવેશ પ મો.

પ્રેમચંદ : કવિરાજ ! ત્યારે મનુષ્ય માત્રના હુઃખને
દાળનારા આરીવાંદરૂપ, તે એકસ.-રૈ-એપેરેટસને રાજ્ય-
સિંહાસન ઉપર પધરાવી, હવે તો તેના બીરદ ગાયે જ
જુટકો છે ને !

માણુસુર : ભલે બાપુને ભલે ! પ્રભુ મારા દાહુલાના
રાજ્યને અવિચળ રાખો. મણિલાઈ શેઠના વેપારમાં
મારો સુરજનારાયણુ વૃદ્ધિ કરો. ભાણુ દાઢો, કુમાર

અભયસીહ, અળ્યસીહ, તથા આ કર્ણપુત્ર પ્રેમચંહ
શેડની આવરદ્ધા વધારે.

દરખારઃ ગઠવી ! આ આપણા ગરાસીયાના ડાયરા
ન હોય ! આ તો આધુનીક સભા સમજ આગળ વધે.
તો રસ આવશે. જોતા નથી કે આ મોકે આપણા કવિ-
તને પણ ખાટલે ચોઢાડી દીધાં છે ?

કુમારી મેના : ભાઈ અળ્યતસીહ ! આ આપણે
રાજકોટમાં ધસ્પીતાલમાં જેસેલા એકસ-રેનાં જ વિશ્વ
દેવાતાં હોય એવું ભાસે છે.

ભાનુમતિ : મેનાએન ! એકસ-રે તો આજકાલ
સહુએ જોયાં હોય. તં બધાં આધુનીક જ ગણ્યાય. અહીં
તો નવીનતા જેવાની કે છે તે તો પ્રાચીન એકસ-રે-
એપેરેટસની છે. તો આ બારોટ બંધુને કહેને કે
પ્રાચીન કાળમાં આપણા દૃષ્ટિમુનિને આ વિદ્યા જ્ઞાત
હતી અને તેવું થંડ તેમને સાધનભૂત ચોજતાં આવ-
કૃતું હતું અને તેને વાપરવાની કુશળતા તેમનામાં હતી.

માણસુર : બાપુ ! આ ડાવકાં ભાનુમતિ બહેન ! આવાં
ચકોર છે એ તો આજે પદરં થયું. કેવો ગજખનો પ્રક્ષ
સુકી દીધો કે જેમાં આજનો વિષય, તેના મહત્વ અને
તેની ઉપયોગીતાનું બધાને ભાન થાય.

અલુતસીંહઃ ગઠવી ! આ સમીક્ષનમાં એ તમારી ઉખીયાણું રોકી, તેની અને કોયડાર્પી “તેનાં નહીં ચાલે એ” તેનાં “અને તેની’માં “તે” કોણુ ? તે તો બતાવો !

માણુસુરઃ કુમાર ! આપને પણુ આ ફેનાં લાનુમતિ જેવા ઈલકાબ મેળવવાની ઉત્કંઢા થઈ લાગે છે. કુમાર ! તમારા પ્રક્ષથી તો તમે અતિ લોળા ઠરે છો. આજને પ્રસ્તુત વિષય અને જેને માણુકથંલ ગળાણો છે, તે તો પ્રાચીન એકસ-કે એપેરેટસના પ્રતિપાદનનાં જ શુલ મુહૂર્ત જેવાણું છે.

મણિચંદઃ કુમાર અલુતસીંહ ! ફેન લાનુમતિ ! હવે તો ગઠવીને થડીથંધ ઇથિમુનિના એપેરેટસની વાત કરવા ધો તો આનંદ આવે. તમારા પ્રશ્નો અને વાક-ચાતુરીની વાહવાહ અમે જોઈ અને સાંલળી. એવી રમ્ભુજ આનંદ દાયક જ હોય પણ તેના સ્થળ અને સમય ઉચ્ચિત મર્યાદામાં તેની શોલા, “અતિ સર્વત્ર વજ્યેત” એ પાડ તો તમે લણ્યા જ હશો.

પ્રવેશ દ ટો.

માણુસુરઃ પ્રથમ પહેલાં વંદુ રાખ લાણુને કે જેના કૃપાકિરણ જગત સકળને જીવન આપી રહ્યાં છે. પૂર્ણી

પર પડતો ભોતીના સર રેડો વરસાઈ આણુનાર તે
આપો ભાણુ છે. જળ આપી પૂઢવીને તર કરી દઈ
તેમાં ઓચેલાં બીજને જગતાં કરી, ભૂમિ બહાર આણુ-
નાર તે સૂર્યનારાયણુનાં ૪૨ જ છે. શ્રીષ્મરતુમાં પોતે
જ લરખી અળખામણી કરેલી લોમીકાને ફરી લીલી
હરીયાળીરૂપી વસ્ત્ર ધારણ પણ તે જ કરાવે છે.
જળની જ્યાંત્યાં રેલંછેલ કરી દઈ, સાથે સાથે આ
મનખા દેહધારીને ચેતાવી હે છે કે આ નિર્મળાં પાણી
એવાં આ ભાણુભાપુને ખધાંએ વંદન કરવાં. આ હાય-
રામાં તે ખધાની વતી એ સૂરજનારાયણુને હું જ વંદન
કરું છું. અજ્ઞાતા ! દાહુલાને ધણી ખમ્મા ! લલે
મણિલાઈ શોઠને લલે ! કુમાર અલયસીહ તો સહા
ભાણુના છતર નીચે અવચળ છે જ !

દરખાર ખહુ ડેકાણુ હું ક્રીએ. અનેક રાજહરખાર
અને ધણુા હાયરામાં મનરંજન કર્યાં, પણ આવો વિષય
લડાવવાનું સૂચન આ પહેલું જ છે. આ વિષય એટલે
પ્રભુની પ્રભુતાના પ્રતિપાદન કરવાનો વિષય. આપણુા
રૂષિમુનિની શર્કરાના ગુણગાન. પૂર્વજોની સંસ્કારિતાના
નેજા રૂપ આ વિષય છે. આલલામાં પ્રકાશતો મહા-
રાજ ભાણુ તે યથાર્થ વર્ણવવા શક્તિ આપે. ધન્ય છે

આ નાના પ્રેમચંદ શેડને ! કે જેણું આવો મહત્વને હિસ્ય ચર્ચાવા અનોખો મોક્ષ અમ જેવાને આપ્યો.

કુમાર અલયસીંહ, લાડકા અજીતસીંહ, આ તમારા લૈરખડા ગોડીઆએ ઓલયા એક્સ-રે-એ. વખાણુ કરવાનાં સૂચનને હું વધાવો લડ્યા છું. કડવા પટેલ અને પાંચા પટેલ અને પરળપતિ કુષેરલાઈ “ જણો, જણો. અને જુએ ! ” કે એક નવી જાને કારણો આ ટોપી-વાળાએ શોધી કાઢ્યો છે. ઘરમાં ચોર પેડો હોય, તેની શોધ કરવા આપણું દીવો સળાગાવીએ, તેવી જ રીતે આ દેહનગરમાં કોઈ ધાડપાડુ કે તસ્કર પેસી ગયો હોય તેને તો કાઢ્યો જ છુટકો. એવો તસ્કર આ દેહનગરમાં પેડો છે, એ વાત અજાણી રહેતી નથી. શરીરમાં તેના ધામાં તો તેના કામાથી પધરા થાય છે. જ્યાં તે પેડો લ્યાં રંઝડ કર્યા વગર રહે નહિ. આવી તેની રંઝડ મનુ-ભ્યમાત્રને ત્રાહિ ત્રાહિ પોકરાવે છે. છતાં તેનો ઉપાય ગોત્યો જડતો નથી. લારે કોઈ જાણુકારને આણુવામાં આવે છે તેને આપણું વૈદ કહીએ છીએ. આપણું હૈદરલાઈ તો હકીમને ઓલાવે. ત્યારે કેવળરામલાઈ દળહર આણુનારા ડાક્ટરના ધર જ શોધે. એ બધા આ આપણું સુંદર દેહનગરમાં પેહેલા ચોરને ગોતવા હાથની રગ્યા

તપાસે છે અને કેમ જણે તે કણાઈ ગયો હોય એવી રીતે વૈદ બાપો તેને ત્યાંથી ખસેડવા કાણૈષધી કે કવાથ આપે છે. ત્યારે આધુનીક ડાક્ટરે તેનું સ્થાન નખી કરવા, કાનરૂપી આંખુમાં સર્પરૂપી ભુંગળીયું ખોસી, રૂપેરી ખુટન ડાબી છાતીએ, જમણી છાતીએ, પેહુંમાં કે આપે વાંસે ફેરવે છે, અને પછી તે જોતરાં કાંનમાંથી કાઢી ખોંખારો જાય છે, તે કેમ જણે ચોરને ગોતી કાઢયો હોય ! પણ કેવળરામલાઈ તો તેના આ ખોંખારાને કેવળ કાચો દમ જ ઠરાવે છે. એ બધા અનુમાનના ગર્ભછાંટના ગોળા જ સમજુ વેવાં કારણુકે જણે આપેલા અગખામણું અને સુગામણું ડોળા પાણીના ડચુરા, આઠ આઠ દિવસ સુધી દચુક્યા છતાં ચોરની રંબડ તો ચાલુ જ રહી; એવામાં પેલા શીતળા ડાક્ટરના જેવી સોયો લોંકનારાને તંડાં જય છે, અને તે આવી જ ડાક્ટરના જેવી ભુંગળીએ લગાડી, તે ચોરનું સ્થાન બરાબર ગોતી તેને લાલાની અણીએ મારી નગરમાંથી દેશવટો હેવાના બીડાં જડપે છે. તે પોતાની છુન્ડાએગ ઉધાડે છે. એ કરશનલાઈ ! એ તમારી વાણુંદની કોથળી નહીં હો ! એને તો ચાંપ હાણી કે જ જીઘડી. તેમાંથી એક કાઢે છે ડાખડી. એ ડાખડી ઉધાડતાં આપણું રૂપથંકરલાઈ પોતાની કુતારી વીભાય ત્યારે

જેમ ઇની ગાદ્યી ગલુડીઅંને સુવાડવા રાખે છે તેવી જ પથારીમાં સુરક્ષિત રાખેલી શીશીઓમાંથી એક હ્યે છે.

ભાઈ ! જરા બત્તી લાવજે તો. તે બત્તી ઊપર સ્કેન આ શીશીનું માણું શેડી, ખીસામાંથી ચાકુથી તે નાની શીશીનું ડોકું તડ કરતું કને ફેડ દ્યાને ઉડાવી હ્યે છે. પછી તો પાંચા પટેલ જેમ હોળીમાં ગીંગરે મળી છોકરાઓ. રંગ છાંટવા પીચકારી રાખે છે તેવી એક નાની પીચકારી એક લાંથી ડાબલીમાંથી કાઢે છે. એ ડાબલી એટલે કેમ જણે અમોકી રતનની વસ્તુ રાખવાની પેટી હોય ! હવે ત્રણું કટક ! હોઈ, તે ફેડ ફેડ ફેડ ચેચે ચડાવી, એ ત્રિપુઠીના ઔક્ય સાધે છે. પછી દ્વા લેણેલું પાણી સ્પીરીટના દીવાની આંચે ખદ્દખદ્દતું કરી, તેમાં તે પીચકારીથી પરપોટા કરવામાં આવે છે.

મેનાઃ ગઠવી માણુસુર ! એ પરપોટા શા માટે કાઢતો હુશે ?

લાનુમતિઃ મેના બા ! એ પરપોટામાં કંઈ અરથ નથી. ખરી વાત તો તે પીચકારીમાં કોઈ રજુણું રહી ન જય, તે માટે દ્વાથી ઘોઈ નાખે છે.

પ્રેમચંદ : ગઠવી ! આ વિગતે ન ઉત્તરીએ તો !

કડવા કાકાઃ એ પ્રેમચંદ શેડ ! જેમ ચાલે છે તેમણે

આતવા ધો. આપ તો શહેરના વતની અને વળી આવા ટોચા ખાઈ ખાઈને ટેવાઈ ગયેલા; એટલે આપને ઈ બધી જણું હોય. અમ જેવા ગરીબ પાસે એ ટોચા આવાની શક્તિ ન હોય, તેથી અમે એ બધું ન જાણીએ હો !

ગ્રેમચંદ્રઃ ધન્ય છે કડવા કાકા ! આપ જેવાને આ બધું નવુંનવું હોય, તેની કદર મેં ન કરી, તેટલા માટે ક્ષમા કરજો. ગઠવી ! જેમ થાય છે તેમ થવા ધો. જેમ સ્વલ્પાવને બારોટો જેટલો ઓળખે છે તેવાં ભાન અમને ન હોય !

આવાં વર્ણન બહું ન કરો તો સાર્દાં ! નહીં તો એ બધાં નવી, કળાના રસીયા અની જશે તો મારો આ ચાક ફરતો બંધ કરવો પડશો. પરલુલાલ વૈધની ખાંડણીયુંના ધખાકા હવે એછા સંભળાય છે. એ હવે ચોતાને જરૂર પડતાં ઓખડીયાં મંબધીથી જાડકારમાંની ચેઢીમાંથી મગાવે છે.

મેનાઃ કાના કાકા ! એ જાડકારમા શું ?

કાનો કુંભારઃ બા, આપ જેવા દરબારની ઢીકરી ચુંને આ જાડકારમાને નથી ઓળખતા ? જેવોને, આ કુંભામાં જટાશ્યંકરભાઈ વૈધરાજ હતાને એની જ જત-

વાળા એ આડવૈધ હતા. એના છોકરા માટેવલાઈ. ના, ના, માઝે કરો. એ માટેવલાઈ નહીં પણ શંકરલાઈ. અને તેના સપુત્ર જગતરામલાઈ છે. આ આડક્રમા એણે જ કાઢ્યું છે.

મેનાઃ ભાનુમતિબા ! તમે કંઈ આમાં સમજ્યાં ?

ભાનુમતિઃ એન, એ જુગતરામલાઈ તો મારા ભાના મિત્ર થાય. તેમણે આ વેદનાં હુઃખ ઓછાં કરવા જંડુ ઝાર્માસ્યુટીકલ વક્સા નામનું કારખાનું કાઢ્યું છે.

મેનાઃ હા આ આ, એ તો હું સમજુ. અવાર-નવાર બાપુ દ્રાક્ષાસવ એ જંડુને જ મગાવે છે. વળી ડેસરીચંહ કાડા આ ચોમાસું ગયે ડેસરીલુવન પણ ત્યાંથી જ મંગાવશે.

માણસુરઃ એ બધાં જીવન, ચ્યવન, પ્રાશાવલેહ, દ્રાક્ષાસવ અને દ્રાક્ષારસ અને આ મેનાખાના આડક્રમા અર્થાત જંડુ ઝાર્માસ્યુટીકલ વક્સા એ બધાંનાં માન અને મરતખા ઉતારનાર આ ઈજીક્શનની વાત પુરી કરી છુટ્યે. હવે આ પીચકારી તૈયાર થઇ. જેમ કેઈ હીરાનો પારખનાર પોતાના નંગને ધારીધારીને નીરખે તેમ, આ ડાક્ટર સાહેબ તે પીચકારીને હાણી અને જમણી આંખે બરાખર તપાસી લઈ, તે માણું ઝાડેલી

નાની શીર્ષીમાંથી તે હવાને પીચકારીમાં ચુસી દ્યે છે.
પણી આયોડીન નામની જંતુધાતક—

પાનાચંદભાઈઃ એ ગઢવી ! અરેરે ! આવા હિંસા-
રમક કથન ન કરો. તો તો ટીક ! અમ જેવા જૈનની
આંતરડી કચવાય હો.।

દાહુલાઃ માણુસુર ! વળી તમારાં પરાક્રમ પદ્ધરાં
કરો છો ને ?

માણુસુરઃ ઘણ્ણી ખર્મા ખાપુને ! પાનાચંદ મેઠા !
આ પાણીના ધુંટડા તમે ભરો છો તેમાં શ્વાસ હો. છો
તેમાં, જંગલે તમે જાઓ છો તેમાં, કેટકેટલા જીવ
ભરતા હશે તે જેતા નથી અને જ્યાં આ માણુસુરે
આવી અગત્યની વાતમાં એક શાળદ ઉચ્ચાર્યો, તેમાં પણુ—

મણ્ણિચંદઃ બારોટ ! તમે ખરા છો એ વાત ટીક.
પરંતુ આવું હાસ્ય ઓછું થાય એ હીજ હોએ અલમનો
આશરો લેવો.

માણુસુરઃ ધન્ય મારા કરણુરાજ મણ્ણિચંદ શોઠને !
ભગવાન શ્રીકૃષ્ણ દીનદયાળુ કહેવાય છે, તેવા જ આપ
હોએ આ પાનાચંદ શોઠના મન મનાંયાં. મહાઅન
પાનાચંદ શોઠ ! આ તો રંગના છાંટણાં ! આપને હુઃખ
દાણું હોય તો ક્ષમા માણું છું.

[૩૫]

પ્રવેશ ઉ મો.

આવી ચકમકની સહેજ જડીને વર્ષાના જળે શાંત કરી નાઈ. સભામાં કેટલાક એવા પણ હતા કે આવા રંગડા જામે તો પોતાને મોઝું મળે, પરંતુ જ્યાં મણુલાઈ જેવા શાણું શોઠ હોય, દાહુલા જેવા દરખાર હોય અને માણુસુર જેવા ગઠવી હોય ત્યાં. અને તેવે સમયે આવી મસ્તીને માગનારાને તે ન મળતાં થપડો જ મળે. પરિણુમે તેમને પણ અન્યની શાંતિમાં સાથ આપવો જ જોઈએ.

દરખારઃ માણુસુર ! હવે તમારાં રંગના છાંટણું થઇ રહ્યાં હોય તો આ એક્સ-રે-એપેરેટસના ચિત્રામણુ આળેખવા મંડી જવ તો ?

માણુસુરઃ ધણી ખમા મારા દાહુલા દરખારને ! શાધારા અને બહેનો ! આપણું દરખારની દ્ધિચાને અનુસરી હવે આ પ્રાચીન એક્સ-રે-એપેરેટસના ધોળ ગવાય છે, તે ધ્યાન દ્ધરી સાંભળો.

કડવી પટલાણીઃ ને ગઠવી બાપા ! જેવાં તો જ્યાંથી અધુરું રાખ્યું ત્યાંથી આગળ હાલી પુરું કરો તો કેમ ? એદ્યા શીતળા ડાક્ટરના ટોંચણુ જેવી વાત તો અધુરી રહી તે તો પુરી કરોને ? પછી તમારું પર-

ચીન અને પરેચીન, ઓદ્ધું અટપડું ! લઈ હૈયે ન ચડે તો હોડેય કચાંથી આવે ?

કાનો કુંભારઃ પટલાણી ! એમ ઘડી ઘડી બધાંય નડતરું કરો તો વાતું કેમ થાય ?

કડવીઃ તી કાના કાકા ! અમારે તો ઓલવાં ચ નંધીને ? આ જીબ સળવળ થાય ત્યારે ઓલવું તો પડેને !

માણુસુરઃ હવે તેણે તૈયાર કરેલી પીચકારીમાં દ્વાની કુંપીમાંથી ઢવા એંચી, હાથ ઉપર આચોડીનના ચોતાંથી ચોક્કસ ભાગ ગોતી, રગને શોધી, તે રગમાં તે ચોય લોંકે છે. તે હેખીતી સોય ભાલે હોય, પરંતુ તે છે ચોલી. અને તેની અણીના ભાગમાં અતિ ભારીક તીણું હોય છે. હવે તે ડાક્તર હાથને સ્થિર રાખી પીચકારીને ડગવા ન હેતાં હળુ હળુ ઉપરનો હાથો હબાવે જાય છે અને દ્વા રજાવાહિનીમાં પ્રવેશ કરી લોહીમાં મળી જાય છે.

પાંચા પટેલઃ તે મોઢા વાટે એવી ઢવા લીધી હોય તો ન ચાલે ? હવે આવાં ટોંચવા શા ? અને આ પ્રીણી પીળી ઢવા લગાડવી શી ?

અભયસીંહઃ જુઓને પાંચા કાકા ! આ મુખ વાટે

પીધેલી દવા અસર તો કરે, પરંતુ તેથી રજે રજે દવાની અસર થતાં વખત લાગે. ગઠવી ! આગળ વધો.

કુમારશ્રી અલયસીહે આ ધન્જેકશાનની વિધિ પુરી કરી. આ તો સાધારણું રોગનો ઉપચાર થઈ ગયો. હવે જ્યારે કોઈ કોઈ પ્રસંગે લાંબા કાળનો મળ કે દુષીત લાગ લેણો થાય છે ત્યારે તેના ઉપર આવી દવા કે ઓખડીયાં કાર કરતાં નથી. છતાં તેવો દુષીત લાગ લાંબો કાળ દેહમાં રહેવા દેવામાં આવે તો તે વધતો જઈ કઢી કઢી પ્રાણુને ઘાતક પણ નીવડે. હવે તેને કોઈ પણ રીતે કાઢવો છે. કઢી કોઈને બંદુકની ગલોલી વાગી હોય, અને તે કાઢવી એટલે આવશ્યક તો ખરી, છતાં તે કયાં પેસીને બેઠી છે, તે ગોતવાને ડાક્ટરની નળી અને દર્દીની નાડ જોઈ નક્કી કરવાનું વેધને માટે મુશ્કેલ થઈ પડે છે.

વળી કઢી આંતરડાંમાં ખગાડો થયો હોય, અથવ ત્યાં પણ જામ્યું હોય તો તેના ઉપાય ડાક્ટરની દવા કે વૈહના ઓખડીયાં નથી. તેના ઉપાયમાં શસ્કદિયા મુખ્ય છે. તે શસ્કનો ઉપયોગ કરવા તે સ્થાન મુકરર કરવું પડે. હવે સૌ જણ્ણે છે તે પ્રમાણે એવું સ્થાન દેહના શીતરમાં હોધિ, દેહને ખોલી, તે સ્થાને શસ્કવૈહને કામુ-

કરવાનું હોઈ વખત તો લાગે. દેહને ઉધાડી તે સ્થાન શોધવા જતાં લોહી બહુ વહી જાય અને દર્દી નાતકા-લિક પ્રાણુ ગુમાવી એસવાનો. તે સંભવ ટાળવા આ ગોરાઓએ એક કારહો શોધી કાઢ્યો છે. તેનું નામ છે એક્સ-રે-એપેરેટેસ. જે ભાગમાં ફુઃખાવો થતો હોય, અથવા જ્યાં મરીનતા લેગી થઈ હોય એવું સ્થાન દર્દીના કહેવાથી, બતાવવાથી કે વૈદ ડાક્ટરના અનુમાનથી ચોક્સ ભાગમાં મુકરર તો થઈ જય છે. હને તે ભાગની પાછળ કાળા રંગની, શરીરથી મોટી ફળી કે તેવું ફ્લેન પાછળ રાખી, તે થંત્રની નોંધ કે ફ્લેક્સ, તે ભાગની બરાબર સીધી લીટીમાં અને સન્મુખ ગોડવી થંત્રમાં વીજળીક પ્રવાહ ચાલુ કરી અતિ પ્રકાશ તે ભાગ ઉપર ફેંકવામાં આવે છે. અદ્વયકાળમાં તે પ્રકાશથી શરીરના ચામડાં અને હાડકાંની આંખી રેખાને વીધી, તે હોષવાળો ભાગ પથરો થઈ જય છે. જે અનુભવી ડાક્ટર આ ભાગનું નિશ્ચિત સ્થાન નીરખે છે, તે પોતાની વધુ ખાત્રી કરવા, પાસે ઉલેવા એક કે અનેક તેવા કામમાં પારંગત અર્થાત નિષ્ણાત ડાક્ટરને પોતે નક્કી કરેલું સ્થાન બતાવી હે છે. વળી મનુષ્ય ભૂત્વને પાત્ર હોઈ ઓવા અનેક નિષ્ણાતો પણ કહી કહી ગોથું ખાઈ જાય, છતાં નિષ્પક્ષપાત એવી જડ પારદર્શક પતરાં રોકી

પારી ઉપર ને જડ પ્રતિકૃતિ હડી આવે છે તેમાં કહી ભૂલ કે ચુક રહેતી નથી. આ પ્રતિકૃતિ કે ફોટોગ્રાફ ઉત્તારવાના કાર્યમાં સફળતા આણુનાર ચંત્ર, તે જ આધુનીક એપેરેટસ છે. હવે તે શાખવૈધ, જેને અંગ્રેજીમાં સરળન કહે છે તેનું કાર્ય અતિ સરળ બની જાય છે. એક ચોક્કસ દિવસ અને વખત નીયત કરી તે હ્યોને તે શાખક્કિયા કરવાનાં સ્થાન, જેને ઓપરેશન થીએટર કહે છે ત્યાં લઈ જવામાં આવે છે. અહી બંધુ વર્ણરૂપીત એટલે કે બગલાની પાંખ જેવું ધોળું ધોળું જ નજરે ચડે છે. શાખ કરવા હ્યોને સુવાડવાનું ટેખલ સફેદ, જેમાં હવા રાખવામાં આવે છે તે કબાટ સફેદ, ડાક્ટરેચે પહેરેલા અણા સફેદ. ડાક્ટરને સહાય કરવા ઉલેલી શુશ્રૂતા સેવિકા અર્થાત નર્સો સુદ્ધાંત તેવાજ ધોળા અણામાં સજબ થયેલી હોય છે.

કડવી પટલાણી: ત્યારે ગઠવી બાપા ! બધાંના માઢ તે ચાક લગાડતા હશે કે ચુનો ? એને ધોળાં કરવાં તો રદ્દાંને ?

પ્રેમચંદ: કડવી કાકી ! મુખ તો જેવાં હોય તેવાં જ રહે હો ! બારોટ, આગળ ચાલો.

માણુસુર: હવે ખરાખરીનો પ્રસંગ આવે છે.

આવા સમયે ખધા ચોતચોતાના કામમાં પ્રવૃત્ત થઈ જાય છે. દ્વારીને સુંવાળા સપાટ ટેખલ ઉપર સુવાઠવામાં આવે છે. શાખપ્રચોગ વિધય હોય તો દ્વારીના હૃથપગ પટાથી બાંધવામાં આવે છે. તે પ્રચોગ પેટે ન કરવાનો હોય અને અન્ય સ્થળે કરવાનો હોય તો સુંવાળા ચામડાના કે રખરના મજબૂત પાટાથી તેને સજજડ બાંધવામાં આવે છે. વારાકુરતી એ ત્રણુ ડાક્ટરો તેની નાડ જુઓ છે. ઝુદ્ધયના ધખકારાની ગણુત્ત્રી છરી તેની નોંધ લઈ દ્વેયે છે. નાડના ઠેકા પણ તેવી જ રીતે નોંધાય છે. આંખના પલકારાની ગણુત્ત્રી થાય છે અને તે નોંધાય છે પણ ખરી. આહિ અનેક સાતચેતીઓ લીધા પછી કલોરાફ્રાર્મ દેવાનું ચંત્ર હાજર થાય છે. હવે દ્વારીને બિશ્વષ્ટ કરવાનો વિધિ શરૂ કરવામાં આવે છે.

કાનો કુંભારઃ તે બસારાને ઈમ ને ઈમ સુવાડીને આ તમારો પરચોગ કરીયો ન હોય તો ન સાલે ?

ભાનુમતીઃ એ કાના કાકા ! જે તે સરજન તેમ કરે, તો તેની છરી આડી અવળી જવાનો સંભવ છે. એક ટાંચણું કે નાની સરખી સોય જરા તમને વાગે તો તમે ડેવા ચમડો છો ? ત્યારે જ્યાં ચામડી ઉતેડવાની હોય, માંસલ ભાગ કાપવાનો હોય, ત્યાં જે તે દ્વારી

શૈશુદ્ધ ન હોય તો તેની તાણ જેંચથી ધાર્યો કરતાં ઉંઘું
કે આડી છરી જતાં ફ્રાયહાને ખદલે મોટો ગેરફ્રાયહો ન
થાય તે માટે આ કલોરોફ્રેઝ આપવાનું સાવચેતી ભરેલું
કોર્ટ છે. કવિરાજ ! તમે તમારે આગળ વધે જાઓ.

માણુસુરઃ કલોરોફ્રેઝ સુંધાંદ્યા એલાં ડાક્ટરના
સાથીએ, તે બધાં શસ્ત્રો અને શસ્ત્રદ્વિયામાં ઉપયોગમાં
દેવાના સાધનોને દવા નાખેલા ખગખળતા પાણીમાં
અધોળીને સાદ્ય તો કરી રાખ્યાં હોય છે જ. છતાં તેથી
તે સરજનને ધરવ થતો નથી. જરા પણ ભૂલ રહી ન
થાય, અને જો તેલું કંઈક કરવાનું બાકી રહી જાય તો,
અહીં એક મનુષ્યની અણુમોલી જંદગીનો પ્રક્રષ્ટ હોવાથી
તે ડાક્ટર તૈયાર રાખેલા ઈલેક્ટ્રોિક સ્ટ્રવ ઉપર, ખદખહ
થતા પાણીમાં પોતાને હાથે જંતુનાશક દવા લેળી
પોતાને હાથે ફરી તે પોતાના ઓઝરો ધુવે છે. ધોયા
પણી તે પોતાને હાથે તેવી જ રીતે જંતુનાશક દવાથી
સાદ્ય કરેલા મોન ચઢાવી હે છે અને વિધિમાં લાગ લેનાર
ડાક્ટરોએ અને નર્સોએ પણ તેવા જ હાથનાં મોનાં
ચઢાવી દીધાં હોય છે.

હુવે બંધુઓ અને જ્હેનો ! સાવધાન થઈ સાંલગો...
આ એક એવો પ્રસંગ છે કે જરાપણ અગાજ થનાં કે

હાથ સહેજ ડગમગતાં કે કોઈને છીંક આવતાં પ્રભુની એક અલોકિક કૃતિ નંદ્વાર્ષ જવાનો સંભવ કે લય આવી ઉલો રહે છે. તેવે સમયે શાંતિ, અડગ શાંતિ—

એકી એ કુકડી, જેતી નથી ? આ માણુસુર બાપા છીંક ખાવાની પણ ના પાડે છે ત્યારે તારા છેડા તો લુધ નાખને ! આ નંધકા કંધ છીંક જેવું થઈ જશે તે તો માણુસુર કાકાના હાથ ધખવા મંડશે અને એદો રોગી મરી જશે. જ્યાં હોય ત્યાં આ સખાળી બેસે જ નંધ.

મેનાઃ અમથી ! બહેન; આ ગઢવી કંધ એપરેશન કરતા નથી. બહેન કુકડી ! તાર્દ નાક લુધ નાખ, એટલે તાર્દ રૂપાળું સુખ વધુ દીપે.

દાહુલાઃ માણુસુર ! આ તાર્દ એપરેશન બહુ બંબાળું હો !

માણુસુરઃ બાપુ ! હવે તો માત્ર ચેપુનો ઘા કરવો રહ્યો. તે હ્યો, એ શાસ્ત્રવૈદ્યને ચોંટીએ લર્દ.

સર્વત્ર શાંતિ વ્યાપી રહે છે. કદ્દી અણુધાયું અને ન ઈચ્છવાનું બની જય તો તેને બ્હાંચી વળવાના સાધન ફરી પાછો એક ડેકટર તપાસી જય છે અને તે સર્વે વ્યવસ્થીત રહે એવો ઈસારાથી સમજનતાં હવે સરજન ચોતાની શરૂઆત કરે છે. કલોરોફોસ્ટ પોતાનું કામ કરી

દીધું છે. પોતાની આસપાસ માત્ર નહીં પરંતુ પોતાએ
ઉપર શું વીતે છે તેનું દર્દીને લાન હેતું નથી. જેમ
કોઈ સુધડ નાર શાક સમારતા સ્થિર ચિત્તે ચાકુનો ઉપ-
યોગ કરે છે તેવીજ રીતે આ શસ્ત્રવૈદ તે ફોટોમાં બરા-
બર નિરીક્ષણું કરી પોતાની છુરી ચલાવી, એક પછી એક
ઓવા ચર્મપટો જોલી ધાર્યો સ્થાને આવતાં ચીપીયાથી
કે અન્ય કાંટા રોકા સાધનથી તે ફુષિત લાગને અદ્ભુત
ઉપાડી, સ્પીરીટની પહેણા મોઢાની શીર્ષી કે ખરણુંમાં
સુકી કાચના બુચથી તેને બંધ કરી હો છે. આ સધળો
વખત કાપેલા લાગમાંથી રક્તપ્રવાહ તો ચાલ્યો જતો
જ હોય છે. શસ્ત્રવૈદ તો માત્ર તે ગાંઠ કે અન્ય જે
કંઈ બગાડ હોય તે પાસે ઉલ્લેખ પોતાના જ ધંધાદારી
બંધુને સોંપી, દવાવાળા પાણીથી તે લાગ ઘોંઠ નાખી,
એક કુશળ દરળુની પેઠે ચર્મપટ જોડી, સાંધી ઉપરનો
પડ્ડો સંધાઈ જાય કે તુરતજ તે ઉપર પાટો બાંધે છે
અને પોતે નિવૃત્ત થઈ જાય છે.

જ્યારે આ શસ્ત્રવૈદ પોતાના કાર્યમાં મમ હોય
છે ત્યારે પણ નાડ જોનારો દર્દીનો હાથ સુકતો નથી.
ક્ષાસનું માપ કાઢનારો ત્યાં ખડેખાટ ઉલ્લો રહે છે.
ડાણી અને જમણી શુશ્રુતા સેવિકા ખડે પગો ઉલ્લી છે.
ચંત્રમાંથી કલોરોફોન્ નિયમિત પ્રમાણુમાં અપાતું જાય.

છે. તે બધી ક્રિયા શક્વૈદની નિવૃત્તિ સાથે આપોઆપ નિવૃત થઈ જય છે. માત્ર નાડવાળો ડાક્ટર નાડ સુક્તો નથી, અને સેવિકાના કામની શરૂઆત હવે જ થાય છે. બોય કહેતાં ઈસ્પીતાલના એ ભૂત્યો સ્ટ્રોચર લાવી, ખડા ખડા ઉલા હોય છે, તેમાં વચ્ચમાં ડાક્ટર અને માથા અને પગને છેડ નર્સો તે હ્યાને અતિ કાળજીપૂર્વક ઉપાડી સ્ટ્રોચરમાં સુક્તતાં જ તે બોય તે હ્યાના બીછાના ચાસે આવતાં ઉપરોક્ત ત્રણો—એ નર્સ અને એક ડાક્ટર તે હ્યાને પથારીમાં સુવાડે છે.

આ બધું સરળતા અને સવળતાથી કરવાના સાધન આધુનિક એક્સ-રે-એપેરેટસ હતું.

મેનાઃ ત્યારે ભાઈ અભયસીહ ! કહે જોઈએ પાશ્ચાત્ય આ ગોધ કરી તે ગોરાઓએ જનતા ઉપર ઉપકાર કર્યો કહેવાય કે નહીં ?

અભયસીહ : એન મેના ! મનુષ્ય જાતિ ઉપર જે જે ઝિઝુનિઓએ ઉપકાર કર્યો છે; તેમાં આ ગોરાંગ તત્ત્વવેત્તાઓએ અનેરો ઉપકાર આ કૃત્યથી કરી આપણું ઝિઝુનિ તે બન્યા છે અને તદ્દર્શી તેવા પ્રતિ આપણે ખૂલ્યલાવ હોય.

માણુસુર : પ્રેમચંદ્ભાઈ ! આ આધુનિક એક્સ-રે

—એપેરેટસના લગ્ન થઈ ગયાં, વરધોડે માંડવેથી વિદ્યાય થયો. વરકન્યાને માંડમાંડ વિશ્રાતિ દેવાને વખત આવ્યો. હવે તો તમારા પ્રાચીન એક્સ-રે-એપેરેટસના ગણેશ પૂજન થાય તો આનંદ આવે.

ભાનુમતિ: કવિરાજ ! અમારા પ્રેમચંહલાઈને માથે ધોંસરુ ચઠાવી બારોટથી પોઆરા નહીં મપાય છો ! દર-બાર બાપુનું સૂચન તો એવું છે કે સંવાદરૂપે આ પ્રાચીન એક્સ-રે-એપેરેટસના ગુણુ ગવાય.

મેના: જેણ ભાનુમતિ ! એ તો બાપુની આજાનું પ્રતિપાદન થશે.

માણુસુર: ત્યારે તો મણિલાઈ શેડ ! મારી યુક્તિ મને કામ ન લાગી. ધણી ખર્મા મારા હાહુલા દરખારને. લલે, પ્રેમચંહ શેડને લલે ! ભાનુમતિ બા ! ધન્ય છે તમને કે આ ગઠવીને ધોંસરેથી છટકવા ન હીધેા ! ત્યારે કહો જેઠ એ પ્રેમચંહ લા ! આ એક્સ-રે-એપેરેટસની શોધ પ્રગતિવાચક છે કે નહીં !

પ્રેમચંહ: ગઠવી ! અવર્ષય, આ શોધ પ્રગતિ જ છે. આ ચંત્રની શોધથી જનતાના અનેક ફર્દી મટે છે, અમૃ-દ્વય એવી અનેક મનુષ્યોની જીંદગીની જ્યોતમાં આ શોધથી ફીવેલ પુરાણા જેવું જ બને છે. અનેક દિવસો

સુધી પથારીવશ થચેલા અને પડેલા ચુવાનેને પાછ ઉલા કરી હસતા રમતા અને મનુષ્યમાત્રને ઉપરોગી થતા બનાવનાર આ યંત્રજ છે. પણ—

માણુસુરઃ પ્રેમચંદ શેડ ! શું ત્યારે તમ જેવા મોટા વેપારીને અને મોટા દેશાવર એડનાર સુદ્ધાને આ પણ નડે ખરેને ? તે તમારા પણતું બણ અજમાવો તો ?

પ્રેમચંદ : ગઢવી ! એ પણ જેવો તેવો નહીં હો ! આ યંત્ર પાક્ષાત્ય પ્રભની શોધ હોઈ તે જડવાદીના વેપારમાં મોટો નહોં કરાવનારં સાધન છે. અમારું તે પ્રાચીન યંત્ર જ્યારે ઉર્ધ્વગામી છે ત્યારે આ શોધ મનુષ્ય માત્રને આ પૃથ્વીના વાસીને ઠ્યેમવિહાર કરતાં સફાને માટે અટકાવી રાખે છે. એકથી અર્થાત આધુનિક એકસ-રે-એપેરેટેસથી મનુષ્યના જીવન જરૂર બને છે, તેની આચુષ્ય લંખાય છે અને તેવા રોગનો સંશય થતાં જ આ યંત્રના સાથથી તે રોગને ઉગતો ડંભી, તેની વૃદ્ધિ થવા હેતા નથી. દુંકમાં કહીએ તો તેથી ઔહિક લાભ મોટો છે ખરો, પરંતુ

અળતસીહઃ લેર્ઝ પ્રેમચંદ ! આ તમારા પણને પલટો પરંતુમાં થચો, છતાં કહો તો ખરા કે તે પણ અને પરંતુના રાન્ય કયાં સુધી આલશે ?

માણુસુરઃ કુમાર અજીતસીંહ ! આ સંવાદનું ઇથે
તો રસે ચડયું હો ! હવેનો લાગ સમજવા આપના
કેવળરામ શાસ્ત્રી અને મણિશંકર મહેતાજ અહીં હોય
તો કેવું સારં !

મણિશંકરઃ ગઢવી ! રખો ચિંતા કરતા. હું અને
કેવળરામલાઈ બંને આ એઠા ! અને કહો તો પ્રેમ-
ચંદલાઈને બહલે એ પરંતુનું મહત્વ કે પણુંની મહત્વી
અમો બંને અથવા એમાંથી એક, જે કહો તે આવી
પ્રતિપાદન કરે.

આ સંવાદની શરૂઆત થતાં જ હળુહળું કરીને
દોકો વીખેરાવા માંડ્યા.

દાહુભાઃ ગઢવી ! કેમ કરશું ? કોણુ, કેળવરામ શાસ્ત્રી
આવે કે મણિશંકર માસ્તર આવે !

માણુસુરઃ લલે બાપુને લલે ! બાપુ ? આ તો ચાણુ-
ક્ષ્ય ખુદ્ધિ હો. આવું કરી તમે પ્રેમચંદ શોઠની સુંઅવણુ
દ્યાણી ! એ તો પ્રત્યક્ષ પ્રેમચંદ શોઠને જ પુછોને કે કોણુ
આવે તો તેને સવળતા મળો ?

પ્રેમચંદઃ શાસ્ત્રીજ ! પધારો પધારો ! પૂજ્ય મણી-
શંકરલાઈ ! આપ પણ અહીં આવો. ગઢવીને શુમાન
આંધું છે કે આ પ્રશ્નનો ઉકેલ મારાથી નહી થાય. આપુ

અને પૂજ્યતું આગમન અને સાનિધ્ય મારા બળને વધા-
શે અને આ કવિરાજનાં વેણુ હેઠાં પડશે. આવાં સૂચન
અતાં જ આ બંને પ્રકારેવો દાયરાની વચ્ચે આવી હેઠા.

પ્રેમચંદ: ગઠવી ! એ પરંતુ એટલે ? ઉગમણું અને
આથમણુના લેહ હેખાડનાર્દં સૂચન. એ પરંતુ એટલે
જડવાદ અને આધ્યાત્મિક દિશાનો અંતર ! એ પરંતુ
એટલે જનમમૃત્યુની પરંપરા અને આત્મજ્ઞાનના પડહા.
એ પરંતુ એટલે પ્રભુથી વિખુટાપણું અને બીજી દિશામાં
પ્રભુનું સાનિધ્ય સૂચવનારી સંજા.

મણિશંકર માસ્તરઃ કેવળરામભાઈ ! આ પ્રેમચંદ-
ભાઈ તો જાની હેખુ હો ! હવે તો તમારાં બ્યાસના
પછ અને શાસ્ત્રીઓની મહત્ત્વી ડોલતી હેખાય છે. જરા
ચાવધાન થશો તો તો ટીક નહીં તો—

કેવળરામ શાસ્ત્રી : ગઠવી ! આ પ્રેમચંદભાઈ જેવા
ચાત્રની આવી ઓળખાણુ કરવા માટે તમને ધન્યવાદ
આપું છું. આવો મોકો પ્રાર્થ કરાવનાર દાહુલા હરભાર
ઉપર પ્રભુના બંને સખણ હુાથ સહા કાયમ રહે. મણિલાઈ
શેડ ! આવો આત્મજ આપને પ્રાર્થ થયો તદ્દર્શી પ્રભુનો
ઉપકાર માનવો જ રહે, ધન્ય છે તેની જનેતાને કે જે
આવા અનાસ્થાના કાળમાં પણ આવા પ્રેમી ને સાથે

સાથે જ્ઞાની પુત્રોના પ્રસવ કરતા રહ્યા છે. બંધુ મણિશંકર ! આપના કથનથી મને આનંદ જ થાય. આવી વિદ્યાવૃદ્ધિ અને જ્ઞાન મનુષ્યમાત્રને સ્વરૂપનું લાન કરાવે, મને તો પ્રેમચંદલાધની વિદ્વત્તા લરેલી વાણી સાંભળવાની છઈંછા થાય છે પ્રેમચંદલાધ ! ચલાવો તમારી તે વાણી !

પ્રેમચંદ : આ પૂજ્ય વડીલોએ મારા ઉપર મોટો ભાર નાખી હીથો. પ્રબુકૃપા હશે તો તે ભારને ચુક્તા થવા હું સામર્થ્યવાન થઈશ.

ગઢવી ! આ પરંતુનું રહસ્ય તમ જેવા ચકોર ગઢવી તો અત્યાર પહેલાં જ પામી ગયા છો. મારા અન્ય વડીલો ! બંધુજનો અને પૂજ્ય જ્ઞાનીએ મને આ રીતે લક્ષ્પૂર્વક સાંભળે છે લારે હું આગળ વધી એમ જ કહીશ કે આધુનીક એક્સ-રે-એપેરેટ્સ એક એવો લાવ નિર્દેખ કરે છે કે જે હેઠમાં પ્રવેશ તો કરે છે પરંતુ સહાને માટે વિનાનીય જ ગણ્યાય. માત્ર વિનાનીય જ નહીં, પરંતુ જેમ એકાદ મહોલ્લામાં પરદેશથી આવેલો કોઈ અકોણો પાડોશી આસપાસના પોતાના બંધુઓમાં લળી ન જતાં, સહાને માટે કોણીએ હલાવી, આગવો થવા પ્રયત્ન કરે કે વેળાએ કે કવેળાએ પોતાના જ ટક્કા ખરા કરે, કે જરા પવનથી પાંદડું.

હાલતાં પાસે ઉકેલા પાડોશી સામે બાંય ચડાવી કુસ્તી કરવા આવાહન કરે તેવા અણુગમતા પાડોશીને ત્યાંથી પાણીચું આપવા તે આપો મહોલ્લો તત્પર બની જાય; તેવી જ રીતે આ વિનાતીય અને વિદેશી બગાડને ઢેખાડી ત્યાંથી તેને ખડતો કરવાની સવળતા આ યંત્ર કરાવે છે. હવે પૂજ્ય શાસ્ત્રીય આપણું પ્રાચીન યંત્ર શું કરે છે તે જોઈએ. જે રીતે આધુનિક યંત્ર શરીરના સર્વો અંગોને લેહી તે બધાને આંધી રેખામાં રહેવા હ્યું પ્રધાનપદ તો તેવા અકોણું અને અળખામણું હુષિત ભાગને આપી તેનું સ્થાન બતાવે છે. આવી જ રીતે શરીરના માત્ર નહીં, પ્રાણીના હેઠ માત્ર નહીં, પણ જરૂર અને ચેતન ચરાચર સર્વમાં રહેલા પટંતરો લેહી આવરણું ઓડાડી જોય વસ્તુનું ભાન કરાવનારું સાધન તે આપણું પ્રાચીન એક્સ-રે-એપેરેટસ.

કેવળરામઃ મણિશંકરલાઈ ! આ હું સાંભળું છું શું ? આ બોલનાર શું એક શાહ વેપારી વૈશ્યનો પુત્ર વળી તેના વયના માન પ્રમાણે આ જ્ઞાન, આ સ્વરૂપનું ભાન, તેની વાણી દ્વારા સાંભળી મારી આનંદની સીમાના ઉલ્લંઘન થાય છે. વીજ્યા દશમીને દ્વિસે રાજાએ અને મહારાજાએ સીમોલ્લંઘન કરે છે ખરા, પરંતુ આ વણીક

સુત્રે જ્ઞાનદિશામાં આ રીતે સીમોલ્વંધન કરી મારા હુદુ—
થને અમૃતનો વર્ષાદ વર્ષાવી શાંત બનાવી દીધો છે.

મહિંદુચંદ્રઃ દરખાર ! સાહેબ ! હવે આ ગ્રેમચંદની
પ્રવતરવેલી ઉક્તિને જે શાસ્ત્રીશ્રી મહિંદુશંકરલાઈ પુણ્ય-
હૃતીદ્વારે ચર્ચાવે તો કંઈ જાણુવાનું નથું મળશે અને તે
પણ શાસ્ત્રીય રીતે થશે.

માણસુરઃ ભલે બાપુને ભલે ! ધન્ય છે મારા
અજ્ઞાનપુત્ર અજ્ઞાનપુત્રનું ! જેણે છ કોડા લેદી મામા
કુણ્ણના પ્રપંચને પ્રલાવે પોતાના પ્રાણુ ત્યાગ્યા, તેવી જ
રીતે આ પ્રાચીન એકસ-રે એપેરેટસ, જે અનેક ગઠ કે
ચક્કાવાને લેદનાડું આર્ય ઋષિ મુનિઓએ આપેલું સાધન
હળ્ણ પણ વિઘમાન છે, તેનું લાન કરાવનારા મારા આ
ગ્રેમચંદ શોઠને ધન્યવાહ છે. અમે જાતે જ માંગણુ રહ્યા
એટલે ધન્યવાહ આપું છું, એ શખ્ફ અમારે મુખે ન
ઉદ્ઘારાય, છતાં દેવીપુત્ર તરીકે લાણુભાપાને પ્રાર્થના તો
કરી શકીએ કે આવા અજ્ઞામોકા રતનને શુક્લ પક્ષતા
ચંદ્રમાની પેઠે સહાય તેની કીર્તિ અને શક્તિમાં વૃદ્ધિ કરે.

દાહુલાઃ શાસ્ત્રીણ ! લારે થઈ જાઓ સાખા, અને
અલાવો આગળ.

કુવળરામઃ મહિંદુલાઈ શોઠ ! આપના મુખમાં તો

આવાં જ વેણુ શોખે. દરખારશ્રી દાહુલા તો અંતે ધર્મ-
રાજનો જ અવતાર ! એટલે એનાં સૂચન પણ તેવાં જ
હોય ! પરંતુ આવી રીતે આ ચુવાન નર પ્રેમચંદલાઈએ
આરંબેલું કથન પ્રેમચંદલાઈ પૂર્ણ કરે, તેમાં આ આખી
સલા, દાહુલા દરખાર તથા પ્રસંગની શોલા જ ઠરશે.
હું બોલીશ, જરૂર બોલીશ પરંતુ તે તો પ્રેમચંદલાઈએ
પૂર્ણ કર્યો પછી તેને ચોણ્ય વર્તાવ કરવા માટે જ.

માણુસુર: ખાપ પ્રેમચંદ ! એમ કંઈ તમને ને મને
આ ઘરડેરા ધોંસદેથી છુટવા હેશે ખરા ! બાપલીયા,
ચલાવ તારાં તે પ્રાચીન એકસ-રે-એપેરેટસને, માર તેને
પરોણો કે તે હવે ચારે પગે ઉલ્લંઘે.

પ્રેમચંદ: મુદ્દખણી ! દરખાર સાહેબ ! પૂજ્ય માવિત્ર
પિતાશ્રી ! નમન કરવાને સ્થાનરૂપ શાસ્ત્રી કેવળરામભાઈ
અને શુરૂપદ હીપાવનારા મણિશંકરલાઈ ! હવે કહેવાનું
રહ્યું નથી. વિષય સમાપ્તિ એ કરી'તી તે થઈ ગઈ. હવે
તો તેનું સીંહાવલોકન કરવાથી આ કૃતિનું સ્વરૂપ યથાર્થ
સમજાઈ જાય. તેટલું જ બાકી કે વિષયાવશોષ રહે છે.

આ જોય વસ્તુ એટલે આત્મા: તે આત્મા જ સર્વ-
ત્મા છે. અને સર્વત્તમા એટલે પરમાત્મા. આ પરમાત્મા
જીનતામાં પરમેશ્વર, ભગવાન; ગ્રલુ આદિ અનેકરૂપે અને

સંજ્ઞાએ ઓળખાય છે. તેની પ્રાસિ આત્મજ્ઞાન કરાવે છે. તે આત્મજ્ઞાનને કરામતીકવતું નીરખવાની ન કહેવાય. તેથી આપણે અહીં અનુભવવાની કહેશું. તે આત્માને અનુભવવાની સવણતા કરાવી આપનાર જે ચંત્ર, ચુક્ષિત કે ગ્રહિયા એ જ પ્રાચીન ઋષિમુનિઓનું આજનું અગ્રપદ્ધારી વરરાણ બની એઠેલું પ્રાચીન એક્સ-રે-એપેરેટસ. તે એક્સ-રે-એપેરેટસ પ્રાચીન હોએ ઋષિમુનિઓ તેને તેની અર્વાચીન ઠે આધુનિક સંજ્ઞા એક્સ-રે-એપેરેટસ અલિધાનથી ઓળખતા નહોતા.

માણુસુરઃ પ્રેમચંદલાઈ ! અહીં સુધી પહેંચાડ્યા પણી અભિમન્યુના ચક્કાવામાં નાખી દીધા. આવા પ્રપંચ તો અમ જેવા કવિઓને માટે જ રહેવા ધો. જ્યાં વાતાનો કે કવિતનો રસલાગ આવી ઉલ્લો રહે એટલે અમારી અકોણી જાત. “ હું તો ખાપુ ! આ પ્રસંગ આવતી કાલે ગાશું. ” આપ જેવા શાહ વેપારીને આ પ્રપંચ શૂષ્ણુ નહીં પણ દૂષ્ણ ઠરે.

ભાનુમતિઃ તે ગઢવી ! આ રીતે વચ્ચમાં બોલી, પ્રેમચંદલાઈને પ્રહાર કરવાનો અધિકાર તમે કચારે આપ કર્યો.

મેનાઃ ભાનુમતિ બા ! આ માણુસુર ગઢવી એવું

ન કરે તો તેના ણારોટપણુને આંખ્પ આવે. પ્રેમચંદ-
ભાઈ ! હવે કૃપા કરી સમજનો તો ખરા, કે તે ઋષિ-
મુનિઓ આપણા આ પ્રાચીન સાધનને કયા અલિધા-
નથી ઓળખતા હતા. આધ્યાત્મિક ભાષામાં તેને કહ્ય
સંજ્ઞા પ્રાપ્ત થઈ છે.

ભાનુમતિઃ જુઓ પ્રેમચંદભાઈ ! એ આધ્યાત્મિક
અને ઋષિમુનિની વાતું તો અમારે ઘરે મારા ભા રેઝ
.કરે છે, તેમાં હું આગળ બહુ લાગ લેતી હતી; પરંતુ
હાલ કંઈક પ્રમાદવશ થઈ, તે અલ્યાસ છોડેલો હોવાથી,
તેમજ આ સલાજનોનો માટો લાગ પણ આધ્યાત્મિક
વિષયથી અપરિચિત હોવાથી સાઢી ભાષામાં આ વિષય
ચર્ચાવશો. તો અમો તમારો ઉપકાર માનશું.

કાનો કુંભારઃ ભાનુમતિ ઓન ! આ અમારી
વકીલાત ઠીક કરી હો ! નહીં તો ઈ બધું આધામીતક
અને એદ્યું માળું જુલેય ચડતું નથી. ઈ બધું અમ
જેવાને કેમ સમજય, માટે પ્રેમચંદભાઈ ! એ તો
આપણી સાઢી અને ઠાવકી વાણીમાં જ સમજવજો.

પ્રેમચંદઃ આપણે હવે આત્માનો અનુભવ કરવાને
માટે શુદ્ધ સાન્નિવી બુદ્ધિની આવર્થયક્તા છે. એ શુદ્ધ
સાન્નિવી બુદ્ધિની પ્રાપ્તિ કરાવનાર બુદ્ધિનિર્મણતા છે.

આવી ખુદ્ધિની નિર્મણતા આખુનાર શુદ્ધાચરણ છે. શુદ્ધાચરણની પ્રાપ્તિ, મનની અહાર લટકવાની ટેવના નીવારણ કરવાથી થાય છે. તે ટેવ છોડાવનારે એક વાત ધ્યાનમાં રાખવાની છે, અને તે એ કે મન સ્વભાવે ચંચળ હોઈ, તેની ચંચળતા કાયમ રાખી કરેલો. પ્રયત્ન જ સંક્રાંતિ થાય. તે ચંચળતા કેમ કાઢવી તેનો ઉપાય આહિ શ્રીમહ શાંકરાચાર્યે પોતાના “સહાચાર” નામક શંખમાં ૯-૧૦ શ્લોકથી બનાવ્યો છે.

મૈનાખેનઃ એ શ્લોક અહો ઉચ્ચારી ખતાવશો
અને અવકાશે લખી આપશો. તો મારી જેવીને માર્ગ-
દર્શક નીવડશે.

લય વિક્ષોપયોર્સંઘૌ, મનस્તત્ત્વ નિરામિષમ् ।

સસંધિ સાધિતો યેન, સ મુખો નાડતત્ત્વ સંશાય ॥ ૯ ॥

સર્વત્ર પ્રાણિનાં દેહે જપો ભવતિ સર્વદા ।

હંસો સોऽહમ् ઇતિ જ્ઞાત્વા સર્વ બંધૈર્પ્રમુચ્યતે ॥ ૧૦ ॥

હું કાના ઠાડાની વાજથી સૂચનાને અનુભરી
આ બધું સાહી લાખામાં સમજલવશું કે આ બધું સતત
અફ્યાસથી—

કાનો કુંભારઃ એ ભાપા પ્રેમચંદ ! વાતું તો સાહી

વાણીની કરો છો અને આ સતત એટલે શું ! એ પુછવા અમારે કેવળરામલાઈના ઉંબરા લાંગવાને ?

પ્રેમચંદઃ ફેરવીને કહેશું કે ચાહુ અજ્ઞયાસ અર્થોિત રોજના મહાવરાથી આ મનની ચંચળતા અર્થોિત વાંદરા જેવો સનભાવ ટળી જઈ તે મન ભીતરમાં જ હંમેશા પ્રવૃત્ત રહે છે. હવે આ મન, ખુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ બધા એક જ વસ્તુ કે પુતળાં છે. જ્યારે તે પુતળું ભીતરની ખડાર ભામતું ફરે છે લારે તેને લોકો મન નામે ઓળખે છે. જ્યારે તેવું તે જ પુતળું ભીતરમાં રહી, પોતાનો વેપાર કે ખેલ કરતું હોય લારે તેને આપણે ખુદ્ધિ નામથી ઓળખીએ છીએ. ચિત્ત તો તે જ કહેવાય કે જે એક સ્થાને ચોંટેલું હોય. આવી રીતે જ્યારે તે એક સ્થાને ચોંટેલું હોય લારે તે નિર્મળું કે ખેલ વગરનું શુદ્ધ બની તેનો એક તકાર છી “ચિત્ત” બને છે. પરંતુ તેની એકાશ્રતા તુટતાં, તે ફરી પાછું જડ બની ચિત્તમાં પહોટો ખાય છે. આ બધું લંબાણું થાય છે અને તેથી માત્ર તેનો દુંકામા ઈસારો કરી હવે આપણા મૂળ મુઢાને ચર્ચાવીએ.

કાના કાકા રોજરોજના રટણુથી આપણે આપણા ભામતા મનને અંતરમાં આણી શકીએ છીએ. અને તેવી

રીતે તે મન ભીતરમાં રમતું થઈ જાય ત્યારે જેમ ગાય
ઉકરડે જઈ ઓખર કરતી આળસી, શુદ્ધ અને સારા
ધાસનો અહાર ખીલે બાંધી કરે તેવી રીતે આ મન
વિષયનો વિચાર છાંડી તે પોતાના પ્રભુના ચરણનું શરણુ
સાધે છે. આવી રીતે હળવે હળવે તે મન જેમ જેમ
ચંચળતા છાડતું જાય છે તેમ તેમ તેને નિર્મણતા પ્રાપ્ત
થાય છે. એ નિર્મણ મનનો પલટો બુદ્ધિમાં થાય છે.
અને રોજરોજના લગવાનના સમરણથી તે બુદ્ધિ શુદ્ધ
સાત્ત્વિકી અર્થાત અતિ નિર્મણ અને કાના કાકાને સમ-
જાવવા માટે કહેશું કે નિતર્યાં પાણી જેવી, ચોખી ચણુક
અની જાય છે. એ શુદ્ધ સાત્ત્વિકી બુદ્ધિ તે આપણું પ્રાચીન
ઓક્સ-રે-એપેરેટસ અને જે રીતે આજનો શાસ્ત્રવૈદ્ય પ્રયોગ
કરે છે તે વિધિ આપણી આર્થિકસંસ્કૃતિની એકાશતા, દ્વા
આદિથી ધોવાની કિયા તે આપણી મનની અને તનની
નિર્મણતા, તે શાસ્ત્રવૈદ્યનું શાસ્ત્રકિયા સમયનું એક ધ્યાન
તે તો આપણા કુદુંખ, ધરાયાર, વ્યવહાર આદિ આસ-
પાસના સંલેખો સાથેનો સખંધ, તેટલો કાળ તોડી નાખ-
વાની નિર્ધિતતા સમજવી. આવું આ આપણું પ્રાચીન
ઓક્સ-રે-એપેરેટસ અને તેવીજ આ શાસ્ત્રકિયા અને તે
શાસ્ત્રપ્રયોગનો વિધિ.

હવે આપણે જેઈ શક્યા છીએ તે પ્રમાણે પાશ્ચા-

ત્ય પ્રબળની આ યંત્રની શોધથી કોડેને ભયંકર રૈગ થતા અટકાવી શકાય છે. કંઈ તેવા રૈગ વધી ગયા હોય તો, તે સારા કરવાના સાથી કે સાધન રૂપ આ યંત્ર બને છે. બંદુકની ગોળી કુમેકમે પાણી કે અજ્જ દ્વારા શરીરના કોઈ પણ લાગમાં લેગી થયેદી રેતી, તે લાંબે કાળે પત્થરરૂપે જામી જય છે, તે કાઢવાને અને તેવા જ અન્ય હોષ કે ફુષિત લાગને આ શરીરરૂપી નગરમાંથી ચદાને માટે દેશવટો આપવાને આ યંત્ર અતિ ઉત્તમ સાધન છે. આપણે તો એટલું જ કહેશું કે આ યંત્રથી મનુષ્યના જીવન સરલ અને આ સ્થૂળ દેહની એવી સરળતાથી ઐહીક વ્યાપારની ઉત્ત્તતિ થાય છે.

ક્રષિમુનિઓનું પ્રાચીન એક્સ-રે-એપેરેટ્સ તે આપણે જોઈ ગયા તે પ્રમાણે ચાલુ અક્ષ્યાસથી તન અને મનની નિર્મણતા પામી, એકાશતાને કેળવી પ્રાસ થતી શુદ્ધ સાત્ત્વિકી ખુદ્ધિ ને આજનું એક્સ-રે-એપેરેટ્સ અને તે જ આપણું આ નાટકનો પ્રધાન નાયક. આ શુદ્ધ સાત્ત્વિકી ખુદ્ધિ દ્વારા આપણે મૂળ સ્થાને પહોંચીએ છીએ અને તે સ્થાન એટલે “યस્મિન् ગતા ન નિર્વત્તન્તિ ભૂયः” કે જ્યાં પહોંચ્યા પછી આ અસાર સંસાર કે અતિ કષ્ટમય યોનિમાં પડવાનો સંભવ નથી.

ગઠવી ! આ વિષયને મારા રામરામ હો અને તમ જેવા ક્રવિને ધન્યવાહ.

દાહુલાઃ શાસ્ત્રીજી ! અને માસ્તર સાહેબ ભણું શંકરભાઈ ! મારા કુમાર તુલ્ય પ્રેમચંદે આ વિષયને ઝડી રીતે લડાવ્યો તો ખરો. સાથે સાથે શાસ્ત્રો, વચ્ચોવૃદ્ધો અને ખાળકો જેવા લોળાં આમ્ય જનોને પણ તુલાલ પુરેપુરો મળો, તદ્ધેર્ય અતિ સાહી અને સરળ ભાષામાં આવો કઠણું અને કપરો વિષય મૃહુ બનાવી દીધો; તો કેવળરામ શાસ્ત્રી કંઈક આપણી વાણીનો જનતાને લાલ આપશો.

માણુસુરઃ ધણી ખરમા મારા શાસ્ત્રી બાપાને ! ભલે દાહુલા દરખારને ભલે ! ધન્ય છે પ્રેમચંદભાઈને ! કે જેણું આપણી પ્રાચીન વિધાને ચુક્તા સ્થાને સ્થાપવાને આટલો આટલો પ્રયત્ન કર્યો. શાસ્ત્રીજી ! પધારો અને આ સિંહના શીશુને ચુક્તા લાષામાં પ્રોત્સાહન આપો.

કેવળરામઃ ક્ષાત્ર શીરેમણુ દરખાર શ્રી દાહુલા ! વેપારમાં કેસરીસીંહ રૂપ મણુલાઈ શેઠ ! અને જાની ચુવક પ્રેમચંદ ! આજનો આ સ્થાનમાં આવવાથી અન્યને કંઈ ને કંઈ લાલ થચો હશે ખરો. પરંતુ તે બધાયે મેળવેલા લાલના સામટા સરવાળા કરતાં પણ

વધારે લાલ મને પ્રાસ થયો છે. મારું કથન એ કંઈ આટની લદ્દાઈ નહીં. મારું સ્થાન અને મારા વચ્ચું માન શું છે, તેનું મને પુરેપુરું ભાન છે, અને તેથી મારાથી અનૃત, જેમાં જરા પણ હોય તેવો ઉચ્ચાર ન થાય, તો પછી તેનો વિસ્તાર કઇ રીતે થઈ શકે. જેના હુદ્ધયમાંથી આ વિષય ચર્ચાવાની પ્રેરણું થઈ હોય તેને પ્રથમ ધન્યવાદ ધટે છે. જીને ધન્યવાદ આપણું આપણું વિક્રાન કવિ માણુસુર ગઢવીને આપણું. જેની ચાણીમાં મધુરતા તો હોય જ; પરંતુ ગઢવી કે કવિ, ખારોટ કે લાટ જરા અટકચાળા તો ખરા. તે શુણું કહેણે અતિ શુણું કહેણે તેને આ માણુસુર ગઢવીએ પોતાના ધરમાં ગરવા દીધો નથી. વિવેકને તો પોતાને આંગણું ઝીલે બાંધી રાજ્યો છે એટલે તેને ઉદ્ઘિતમાં વિવેકનું જ મિશ્રણું હોવાથી, ગમે તેવા સાધારણું વિષયને તે અતિ ઉચ્ચ વિષયમાં ફેરવી શકે છે. તેમાં તો આજનો આ ગહુન વિષય તેને તેણું બરાબર ન્યાય અપાર્યો છે. પ્રાચીન ઋષિમુની તરફનો પક્ષપાત, અને સાથેસાથ આધુનિક આશીર્વાદ રૂપ આ ચંત્રના દરેક-દરેક ભાગને અને તેમાં આવશ્યક પ્રત્યેક કિયાના કેમ જણે તે લાંબા કાળના અક્યાસી હોય તે રીતે તેણું આ શરૂપર્યોગને ચર્ચાવ્યો છે. ધન્ય છે તેની જનેતા

હેવીને કે જેણે આ માણુસુર જેવા હીરાને પ્રસવી જનતાઃ
ઉપર ઉપકાર કર્યો છે.

આ પ્રેમચંદ પુત્રને પ્રારંભમાં જ ઉક્ત કવિએ
વધાવી તો લીધા. મારા હૃદયમાં તેણે સ્થાન લીધું છે,
તેનું મુખ્ય કારણ એટલું જ કે આધુનીક કેળવણીના દોષ
કે કાંટાળા લાગને પોતાનો સ્પર્શ ન થવા હેતાં તેના
પરિમળ અને હિતકર લાગને એણે પોતાનો કરી લીધો
છે. સાથે સાથે ઋષિમુનીની પ્રાચીન વિદ્યાને પણ યથાર્થ
કેળવી તે અમૃતના પાન તેણે કર્યાં છે અને તે વિદ્યાને
પોતાની રેણેરગમાં પચાવીને ઉતારી દીધી છે. આધુનીક
કેળવણી એટલે પ્રલુ તરરેના લાવનો અલાવ. આધુનીક
કેળવણી એટલે વડીલો અને ગુરુસ્થાને વિરાજતા અન્ય
વૃદ્ધજનો તરરે અતડાપણું. આધુનીક કેળવણી એટલે
માવિત્રોની અવગણુના. આધુનીક કેળવણી એટલે જ્યાં
સંસ્કૃત શાખાઓચાર થાય કે તુરત જ નાકન! નસ્કેરાં ચડા-
વવા. એવા સર્વ દ્વારો કે લક્ષ્ણોને આ પ્રેમચંદ પુત્રે
પોતાની પાસે આવવા દીધા નથી, તો તેને સ્પર્શ કર્ય
રીતે? મારી આ ઉક્તિમાં હું વિષયાંતર કરી રહ્યો છું.
તેનું મને પુરેપુરું લાન હોવા છતા અમ જેવાને આવા
મોકા કવચિત્ મળતા હોવાથી જનતાને તેથી લાભ
જ થશે એ માન્યતાએ એટલું જોખવાને પ્રેર્યો છે. પુત્ર

પ્રેમચંદ ! તમારી જેવા ચુવકને પ્રોત્સાહની જડી ન જ હોય, છતાં તેના પ્રોત્સાહન તમદ્વારા અર્થાત તમારે નિ-મિત્તે ખીજ પ્રાપ્ત કરે, માત્ર તેટલા જ હેતુથી હું આપને આજના આ વિષયને યર્થાર્થ ચર્ચાવા માટે ધન્યવાહ આપું છું.

હુવે વિષયને ધન્યવાહ આપવાનું અર્થાત તેનું તાર-તમ્ય ખતાવવાનું કાર્ય હાથ ધરીશ અને તે તો સંક્ષિ-પ્તમાં જ ધરો. આ યંત્રની શોધ કરીને પાશ્ચાત્ય વિજ્ઞા-નીઓએ જનતા ઉપર ઉપકાર કર્યો છે. તેની શોધ આશી-વાહ સમાન કહો કે અમૃત સમાન મનુષ્યનું આયુષ્ય લંખાવનાર્દ સાધન છે. પ્રગતિ દિશાની વાત કરીએ તો અવશ્ય આ યંત્ર પ્રગતિસૂચક માત્ર નહીં પરંતુ ખરેખરી તેમાં પ્રગત કરી પડી છે. આટલો ધન્યવાહ તે વિજ્ઞા-નીઓને અને આશીર્વાહ તેની આ શોધને આપ્યા પણી પણ મારે કહેવાનું તો રહ્યું જ કે આ શોધ એટલે અપરા દિશામાં મનુષ્યની પ્રવૃત્તિ અને પ્રગતિ કરાવનાર્દ સખળ સાધન આ માર્દ કથન સાક્ષેપ અર્થાત સરતી છે, અને તે એ કે તેની તે યંત્રની સહાયથી પ્રાપ્ત થતું સ્વાસ્થ્ય અને શરીરની સુદૃઢતાનો ઉપયોગ જો આત્મ-જ્ઞાનની પ્રાપ્તિમાં વાપરવામાં આવે તો મારે કંઈ વધુ આલવાનું રહે નહીં. પરંતુ જે રીતે તે પાશ્ચાત્ય વિજ્ઞા-

નીચો અને શોધકો પારમાર્થિક દિશા તરફ પ્રમાણી રહે છે ત્યાં સુધી તો મારું આ કથન માત્ર સ્થાને નહીં પણ આવશ્યક છે.

પ્રાચીન સંસ્કૃતિ એટલે પરા દિશામાં પ્રગતિ. પ્રાચીન સંસ્કૃતિ એટલે સૂળ સ્થાને ખેંચાડવાની તત્પરતા. પ્રાચીન સંસ્કૃતિ એટલે સ્વરૂપ સાથે સંધાન કરાવનારી શૂંખલા. પ્રાચીન સંસ્કૃતિ એટલે ઉજ્જ્વાત માર્ગ દેખાડનારું સાધનબોર્ડ, તેથી જ આ આપણું પ્રાચીન યંત્ર પરાવિદ્યાનું એક અંગજ ગણ્યાય અને જે રીતે અર્વાચીન યંત્રનો ઉપયોગ થાય છે તે તો સોળેસોળ આના અપરાવિદ્યાનું અંગજ ગણ્યાય. કારણું તેનો ઉપયોગ માત્ર સ્થૂળ દેહને સુહૃદ બનાવવામાં વાપરવામાં આવે છે.

દાહુભાઃ માસ્તર સાહેબ ! આપને હાથે પૂણુર્હુતિ થાય એવી મારી ઈચ્છા છે.

મહિશંકરઃ બંધુઓ અને ખેંચનો ! આપણા શાસ્ત્રીજુને સંલગ્ના પછી બોલવું એટલે અમૃતપાન કર્યો પછી રોટલામાં મીઠાશ કેવી હશે ? તેવા શુમાન સિવાય વધુ કંઈ ઠરતું નથી. આપણા શાસ્ત્રીજુએ આધુનીક કેળવણી પર તો જે કંઈ શબ્દો કણ્ણા છે તેનો સ્વીકાર કરું તો શિક્ષક મંડળ તરફથી મને સર્જ થવા સંભવ રહે છે.

તોના કથનમાં સલ્ય છે તે વાતનો સ્વીકાર કરવા છતાં હું કહીશ કે શાસ્ત્રીજીના ટેકા માત્ર ખાણુરૂપ જ નહીં, પરંતુ અસ્થાને છે. જેવું આધુનીક કેળવણીમાં ફ્રાણુ શાસ્ત્રીજી જીવે છે તેવું ફ્રાણુ તો પ્રત્યેક પ્રવૃત્તિમાં હોય જ. મોટા અને માનવંતા પરોણુને જમાડવાના થાળ પીરસાય છે. લારે મિદ્ધાજ્ઞની સાથે ખારે તીખો પદ્ધતિ પીરસવામાં આવે છે, તેવી જ રીતે પ્રત્યેક પ્રવૃત્તિમાં હોષ તો રહેવાના જ. તેનું પ્રમાણુ અદ્ય હોય લાં સુધી કોઈને કંધ કહેવાનું રહેતું નથી.

ધન્ય છે પ્રેમચંદભાઈને કેનેને શાસ્ત્રીજી સન્મુખ ઉલા રાખી હું નિશ્ચિતભાવે કહી શકું છું કે શાસ્ત્રીજી જીવો, આધુનીક કેળવણીના આદર્શરૂપ આ પ્રેમચંદભાઈને ! તેને મારે ધન્યોદ્યાર તે શાસ્ત્રીએ હમણું જ કાઢ્યા તે વધુ ખોલવાપણું મારે મારે હોય જ નહીં. માત્ર માણુસુર ગંઠીને મારા જેવો અભ્યયોનિ પ્રાસ અનાયાસે નમન કરે છે.

માણુસુરઃ લલે, બાપુને લલે ! મણુશંકર બાપાને મારા નમન હો ! શાસ્ત્રીજી કેવળરામને તો મારા સાણંગનમસ્કાર જ શોલે. પ્રેમચંદ બાપલીઅ ! આવ, આવ. લેટ, આપુ લેટ મને ! તમ જેવા ચુવકોમાં તો અમારી ચારણી

વિદ્યાના આવરદ્ધાના આશાવંતા કુંપળાના મને હર્ષન થાય
છે. હું જ ટાઠક વળે છે અને વળી આશા ઉત્પન્ન થાય
છે કે આ ચારણી વિદ્યાનો જગત અસ્ત અને નાશ જોઈ
રહી છે તેને આવા પ્રેમચંદ્રો જીવતી રાખશે એટલું જ
નહિ, પરંતુ તેને રૂષ અને પુષ્ટ અનાવશે. ધન્ય છે યુવક
પ્રેમચંદ્રને !

દાહુલા દરખારઃ કામહાર ! લાવો તે ચીજો. શાસ્ત્રીજ !
આપને હાથે આ વસ્તુ મારે ગઠવીને આપવી એમ કહી
એક સ્થાનાનું બાંહેનું કડું કેવળરામના હાથમાં દરખારે
મૂક્યું .

કેવળરામી તે મણિચંદ શોડના હાથમાં આપ્યું અને
સુચન કર્યું કે આપ શોડ તે ગઠવીને નવાજો તો ઢીક.

મણિચંદ શોડ ભિલા થઈ, ગઠવી માણુસુરને તે કડું
અર્પાતા તેના વખાણ કર્યો, લારે કામહારે આપેકી
Morroco leather bound શોપનહોરનો છ અંધોનો
સેટ કેવળરામ શાસ્ત્રીના હાથમાં મૂક્યો. જે તેણે આજની
સલ્લાના નાયક પ્રેમચંદ લાઇને સમયો.

હું મણિચંદ શોડે ખીસામાંથી એક કાગળની
ડાખલી આપી અને મણમલનો સુશોલીત ડેસ આપ્યો.
કાગળની ડાખલીમાંથી સોનાનો એક ચાંદ કાઢી પ્રેમચંદે

ગઠવીને ઉલા થવાનું સૂચન કરી, તેની છાતીએ લટ-
કાંદ્યો. તે ચાંદમાં માણુસુર ગઠવીનું નામ તથા કવિ-
ત્વના શુક્ત વખાણુ હતાં. કેસ તો તેને હાથોહાથ
સુપ્રત કરી હીધો.

માણુસુરઃ ભલે બાપુને ભલે ! દાહુભા દરખારનું
રાજ અવિચળ તપો, ધન્ય મારા પ્રેમચંદ શેઠને કે
જેઓ આવી લરસભામાં સલાજનોની મોઝુંના અધિ-
કાર પામી અમારા જેવી જ સોગાડો મેળવે છે.
શાસ્ત્રીજ ! આપે જે ઉદ્ગાર કાઢ્યા કે આજનો હું
આ કેવળરામ શાસ્ત્રીને થાય છે તેના જેવો અન્ય
કોઈને ન થતો હોય એ કથનને હું સ્વીકારતો નથી.
આપને થયેલો હું ગમે તેવો ઉત્કૃષ્ટ હોય, પરંતુ તેમાં
આવા ચાંદ અને આ કડાના મિશ્રણ ક્યાં ?

દાહુભાઃ અંતે ચારણુ તે ચારણુ હો ! ક્યાં શાસ્ત્રીજના
હુદ્ધયની પ્રસન્નતા અને ક્યાં તારાં આ ધાતુના રમકડાં !
માળા શાસ્ત્રીજને છેડી ગઠવી તેં શું લાલ કાઢ્યો.

માણુસુરઃ ભલે બાપુને ભલે ! એ તો અજદાતા !
આવી અટકચાળી ન કરીએ તો અમે ગઠવી શાના ?

સર્વે જના સુખીનો ભવંતુ.



કણુમુક્ત-લેખમાળા.

રા.આ.પા.

૦-૨-૦

મણુકો ૧ અલૈનીકિક અમૃત	૦-૨-૦
,, ૨ કાંકરીનાં કષ અર્થાત્ મનુષ્ય માત્રનાં ત્રણ આવશ્યક સાથી	૦-૨-૧
,, ૩ “ રાધા ”	૦-૨-૦
,, ૪ કર્મચારી	૦-૧-૩
,, ૫ આર્યસંસ્કૃતિનું પ્રાચીન એક્ષરે એપરેટસ	૦-૫-૦
,, ૬૫૪૫૫ સાથે ભાંડેલા પુસ્તક	૦-૬-૦

આ લેખકના અન્ય પ્રકારાનો

મણુકો ૧ લો. ગીતા પ્રવચનનું એક પ્રકરણ	૦-૨-૦
,, ૨ જો શ્રી રામાયણ તત્ત્વ રહુસ્ય (૧ લી આવૃત્તિ)	૧-૦-૦
,, " " (૨ જી આવૃત્તિ)	૧-૪-૦
,, ૩ જો ભાન્ધાતા આજ્ઞાન	૦-૮-૦
,, ૪ થો. વિષણુની પેટ પીડ	૦-૮-૦
,, ઉંઘ બંને સાથે ભાંડેલાં પુસ્તકની કિંમત	૦-૧૪-૦
,, ૫ મો. બચુબાઈ બીજી આવૃત્તિ	૦-૬-૦
,, ૬ હું હુરિજન	૦-૧-૦
,, ૭ મો. સરસ્વતીની સહનશીલતા	૧-૧-૦
,, ૮ મો. Wealth and Wealthy	૦-૧-૦

મણુડો દ મો શ્રીમંચંકરાચાર્ય	વિરચિત 'સદાચાર'	
સાધુપુરખ હંસદેવામીની એવી એક		
મરાડીના ગુજરાતી અતુનાદ	૧-૦-૦	
,, ૧૦ મો ક્રન્દાતીત અવધુત અર્થાત्		
તિતિક્ષાની પરિસીમા	૧-૦-૦	
,, ૧૧ મો કદ્યપના સૃષ્ટિ અને અહી કદ્યપના		
અર્થાત् હુરદત અને હેવદત ચુરે		
શિષ્ય સંવાદ સ્થાપિત અદ્યૈ	૦-૪-૦	
,, ૧૦x૧૧ અને સાથે બાંધેલાં પુસ્તક	૧-૪-૦	
આ બધાં પુરતડો રોકડેથી નીચેનાં ડેકાશેથી અગર જાણીતા ખુક્સેલર પાસેથી ભળશે. ટપાલ ખર્ચ જુદું આપવું પડશે.		
(૧) મેસર્સ એમ. આર. વેદની કું. (લેખકની ઓારીસમાંથી)		
આગામાન બીલ્ડિંગ દલાલ રદ્દીટ ફેસ્ટ મુંબઈ		
(૨) મૂલજી રણુછોડ વેદ નં. ૭૭ શ્રીન બંગલો અંદેરી (B. B. C. I.)		
(૩) મૂલજી રણુછોડ વેદ શ્રી ભાટિયા મિત્રમંડળ સુખઉવાલા બીલ્ડિંગ રેવલીન રદ્દીટ ફેસ્ટ, મુંબઈ		
(૪) અમરેલીમાં લેખક મૂલજી રણુછોડ વેદની દુકાનેથી આખો સેટ લેવા છુંચા ધરાવનારે લેખકની મુંબઈની ઓારીસે પત્રઅનુભાર કરવાથી વ્યાજખી કમીશન આપવામાં આવશે.		

મૂલજી રણુછોડ વેદ
આગામાન બીલ્ડિંગ દલાલ રદ્દીટ ફેસ્ટ, મુંબઈ.

